Sun Pharmaceutical Industries Ltd.

Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063, Maharashtra, INDIA.

Tel.: (91-22) 4324 4324 Fax: (91-22) 4324 4343

Website: www.sunpharma.com CIN: L24230GJ1993PLC019050



March 10, 2018

National Stock Exchange of India Ltd, Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400 051.

NSE Code: SUNPHARMA

BSE Limited., Market Operations Dept. P. J. Towers, Dalal Street, Mumbai - 400 001. BSE Code- 524715

Sub: Notice for transfer of equity shares and unclaimed dividend to the Investor Education and Protection Fund (IEPF) Suspense Account

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of the notice published in Financial Express—English Daily(All Editions including Gujarati Edition) in English language on March 9, 2018 and in Financial Express (Gujarati Edition) in Gujarati language on March 10, 2018 in accordance with the Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, requesting the concerned shareholders to take appropriate action to claim their dividend, which has not been paid or claimed by them for seven consecutive years or more, failing which their shares and unclaimed dividend will become liable to be transferred to the IEPF Suspense Account.

This is for your information and records.

Thanking you,

Yours faithfully,

For Sun Pharmaceutical Industries Limited

Ashok I Bhuta Compliance Officer

Encl.: As above.

Registered Office: SPARC, Tandalja, Vadodara - 390 020, Gujarat, INDIA.



BHAROSA APNO KA **HDFC Asset Management Company Limited** A Joint Venture with Standard Life Investments

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676 Fax: 022 22821144 • e-mail: cliser@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

CIN: U65991MH1999PLC123027

NOTICE

Launch of Plan under HDFC Fixed Maturity Plans - Series 39

NOTICE is hereby given that the New Fund Offer (NFO) of the following Plan under HDFC Fixed Maturity Plans - Series 39 (a close-ended income scheme), will open and close for subscription as under:

Name of Plan **NFO Opening Date NFO Closing Date** HDFC FMP 1147D March 2018 (1) March 15, 2018 March 20, 2018

Investors may note that the units of the above-mentioned Plan will be listed on the Stock Exchange(s) as mentioned in the Scheme Information Document where they can purchase / sell units on a continuous basis.

For HDFC Asset Management Company Limited

MUTUAL

Place: Mumbai Date: March 08, 2018 Chief Compliance Officer

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS. READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

CANARA ROBECO

Canara Robeco Mutual Fund

allocated as follows:

Investment Manager: Canara Robeco Asset Management Co. Ltd.

Construction House, 4th Floor, 5, Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400 001. Tel.: 6658 5000 Fax: 6658 5012/13 www.canararobeco.com CIN No.: U65990MH1993PLC071003

NOTICE - CUM - ADDENDUM

All the Unit holders of Canara Robeco Mutual Fund are requested to take note of the following changes:

1. Changes in the Key Personnel of Canara Robeco Asset Management Company Ltd:

Ms. Cheenu Gupta is appointed as 'Fund Manager - Equities' of Canara Robeco Asset Management Company Limited with effect from 1st March, 2018. Her details are as follows:

| Name | Age/Qualification | Brief Experience | |
|---------------------|---|---|--|
| Ms. Cheenu Gupta | 37/CFA Charter holder (USA), PGDBM (Finance) and B.E. (I.T) | Total experience - 12 years Details: Fund Manager - Equity - Tata AIA Life Insurance Company (August 2009 to February 2018) Senior Research Analyst - ING Investment Management (September 2007 to August 2009) Research Analyst - UTI Asset Management Company Ltd. (May 2006 to September 2007) | |

Consequent to her appointment, the following scheme will be managed by Ms. Cheenu Gupta with effect from 12th March, 2018:

| Scheme Name | | Existing Fund Manager | New Fund Manager | |
|-------------|--------------------------------|--|------------------|--|
| | Canara Robeco Equity Tay Saver | Mr Yogesh Patil and Mr Ravi Gonalakrishnan | Ms Cheenu Gunta | |

2. Change in the Fund Management responsibilities of Canara Robeco Mutual Fund ("CRMF") Schemes: Pursuant to the resignation of Mr. Kartik Mehta (Fund Manager - Equities), all references to Mr. Kartik Mehta in the Statement of Additional Information ("SAI"), Scheme information Document ("SID") and Key Information Memorandum ("KIM") of the Schemes of Canara Robeco Mutual Fund stand deleted. Consequently, the Fund Management responsibilities of the schemes managed by Mr. Kartik Mehta are

| Scheme Name | Existing Fund Manager | New Fund Manager |
|--|---|--|
| Canara Robeco Emerging Equities | Mr. Ravi Gopalakrishnan and Mr. Kartik Mehta | Mr. Ravi Gopalakrishnan |
| Canara Robeco Capital Protection Oriented Fund - Series 6 | Mr. Ravi Gopalakrishnan, Mr. Kartik Mehta and Ms. Suman Prasad | Mr. Ravi Gopalakrishnan and Ms. Suman Prasad |

All other terms and conditions of the above Schemes remain unchanged. This addendum shall form an integral part of the SAI/SID/KIM of the Scheme(s) of Canara Robeco Mutual Fund as amended from time

> For and on behalf of Canara Robeco Asset Management Company Ltd. (Investment manager for Canara Robeco Mutual Fund)

> > MUTUAL

Mumbai

March 08, 2018

Date: 08-03-2018

Authorised Signatory Place: Mumbai

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

HDFC MUTUAL FUND BHAROSA APNO KA

HDFC Asset Management Company Limited

A Joint Venture with Standard Life Investments CIN: U65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676 Fax: 022 22821144 • e-mail: cliser@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

ADDENDUM to the Statement of Additional Information dated June 29, 2017 UPDATE ON INFORMATION ABOUT STANDARD LIFE INVESTMENTS LIMITED, CO-SPONSOR OF HDFC MUTUAL FUND

Investors are requested to take note of following update about the "Standard Life Investments Limited, Co-Sponsor ("SLIL") of HDFC Mutual Fund (the "Fund").

Merger of Standard Life plc and Aberdeen Asset Management PLC

In 2017, Standard Life plc merged with Aberdeen Asset Management PLC forming the Standard Life Aberdeen Group. On completion of the merger, Standard Life Investments Limited ("SLIL") remains a wholly owned subsidiary of Standard Life Investments (Holdings) Limited ("Hold Co."), which in turn is a wholly owned subsidiary of Standard Life Aberdeen plc, the ultimate parent of the Standard Life Aberdeen Group. The Securities and Exchange Board of India ("SEBI") vide its letter no. IMD/DF3/ OW/P/2018/4579 dated February 12, 2018 took note of the same.

Investors are requested to take note that pursuant to the said merger:

- There will be no direct or indirect change in control of HDFC Asset Management Company Limited ("HDFC AMC");
- There will be no change in the shareholding of HDFC AMC, SLIL, or the Hold. Co.:
- There will be no change in the board composition of HDFC AMC, SLIL, or the Hold. Co.;
- The will be no change in the Sponsors of the Fund; and
- There will be no change in the name of the Fund and/or the scheme(s) offered by the Fund; In view of the above, the information about Standard Life Investments Limited, Co-Sponsor of the Fund

appearing in "Sponsors" under section "Information about Sponsor, Asset Management Company and Trustee Company" of the Statement of Additional Information ("SAI") of the Fund shall stand replaced and updated as under:

"STANDARD LIFE INVESTMENTS LIMITED

Standard Life Assurance Company ("Standard Life") was, founded in 1825 and present in the Indian life insurance market from 1847 to 1938 when agencies were set up in Kolkata and Mumbai. Standard Life re-entered the Indian market in 1995, launching an insurance joint venture with HDFC.

In 1998, Standard Life Investments launched as a separate company, rapidly becoming a leading global asset manager. In 2017, Standard Life merged with Aberdeen Asset Management forming the Standard Life Aberdeen Group

Standard Life Aberdeen is one of the world's largest investment companies, dedicated to creating long-term value for clients and shareholders.

On completion of the merger, Standard Life Investments Limited remains a wholly owned subsidiary of Standard Life Investments (Holdings) Limited, which in turn is a wholly owned subsidiary of Standard Life Aberdeen plc, the ultimate parent of the Standard Life Aberdeen Group.

While retaining distinct investment philosophies and processes, Standard Life Investments and Aberdeen Asset Management share a set of common investment beliefs. The combined investment business has a substantial global presence with clients across 80 countries and £575.7bn assets under management*. It manages a diverse portfolio covering all major markets world-wide, including a range of private and public equities, government and company bonds, property investments and various derivative instruments. For more information log on to www.aberdeenstandard.com

*AUM of Aberdeen Standard Investments based on a Pro forma basis as at 31 December 2017."

All other contents of the SAI of the Fund will remain unchanged.

This addendum shall form an integral part of the SAI of the Fund as amended from time to time.

For HDFC Asset Management Company Limited

Place: Mumbai Date: March 8, 2018

RELATED DOCUMENTS CAREFULLY.

Chief Compliance Officer

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME

18 NATION

Sun Pharmaceutical Industries Limited

Regd. Office: SPARC, Tandalja, Vadodara - 390012, Gujarat, INDIA Corporate Office: Sun House. Plot No. 201 B/1, Western Express Highway.

Goregaon (E), Mumbai - 400063 Tel: +91 22 4324 4324 CIN: L24230GJ1993PLC019050 Website: www.sunpharma.com PHARMA

NOTICE

Transfer of Equity Shares and unclaimed dividend to Investor Education and Protection Fund (IEPF Suspense Account

Notice is hereby given that pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 notified by the Ministry of Corporate Affairs effective September 7, 2016 and as amended from time to time thereafter ("the Rules").

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares, in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, to the Investor Education and Protection Fund Suspense Account ("the IEPF Suspense Account").

Pursuant to the provisions set out in the Rules, the Company has communicated through individual notice(s), to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Suspense Account under the said Rules for laking appropriate action(s).

Erstwhile Ranbaxy Laboratories Limited ("Ranbaxy") had been merged with Sun Pharmaceutical Industries Limited ("the Company") w.e.f. 24" March, 2015 through a Scheme of Merger ("Scheme") as approved by the Hon'ble High Court of Punjab & Haryana and Hon'ble High Court of Gujarat. Pursuant to the Scheme, shareholders of erstwhile Ranbaxy were issued shares of the Company in accordance with the ratio prescribed in the Scheme. Out of the above shares, the shares on which dividend has not been paid or claimed for seven consecutive years or more, are now liable to be transferred to the IEPF Suspense Account,

The Company has uploaded full details of such shares which are due for transfer to IEPF Suspense Account on its website at http://www.sunpharma.com/investors/shareholders-information/details-of-shares-to-iepf, and the shareholders are requested to verify the details of the shares liable to be transferred to IEPF Suspense Account.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Suspense Account, may note that, as per the requirement of the Rules, the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) which are registered in their name and these original share certificate(s) will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be regarded and shall be deemed to be adequate notice in respect of issue of the duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Suspense Account pursuant to the Rules.

In case the Company does not receive any communication from the concerned shareholders by May 8, 2018, the Company, with a view to comply with the requirements set out in Rules, shall transfer the shares and unclaimed dividend (declared on May 16, 2011 by erstwhile Ranbaxy) to the IEPF Suspense Account by the due dates as per procedure stipulated in the Rules

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to IEPF Authority/ IEPF Suspense Account including all the benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority/ IEPF Suspense Account, after following the procedure as prescribed under the Rules.

In case the shareholders have any queries on the subject matter, they may contact the Company's Registrar and Share Transfer Agent - Link Intime India Pvt. Ltd., C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli West, Mumbai - 400 083. Tel No.: (022) 49186270, E-mail: mt.helpdesk@linkintime.co.in.

By order of the Board of Directors For Sun Pharmaceutical Industries Ltd.

Place: Mumbai Date : March 6, 2018

Ashok I. Bhuta Compliance Officer

SC questions govt on 'exorbitant' medical treatment

PRESS TRUST OF INDIA New Delhi, March 8

THE 'EXORBITANT' COST of medical treatment in India drew attention of the Supreme Court on Wednesday and it asked the government to 'do something' as the people were unable to get treatment due to the 'huge cost'.

The apex court's remarks assume significance as the National Pharmaceutical Pricing Authority (NPPA) had recently said that non-scheduled drugs and diagnostic services constituted major components of charges billed to patients in four private hospitals in Delhi and national capital region (NCR) with margins as high as 1,192%.

As per an analysis done by the NPPA, the margin on procurement price of drugs used in emergency cases for treatment of potentially lifethreatening low blood pressure was 1,192%. The drug pricing regulator had recently

said that in case of Adrenor 2 ml injection with an MRP of ₹189.95, the purchase price for the hospitals was ₹14.70 but the patients were being charged ₹5,318.60,including taxes.

"The cost of medical treatment is exorbitant in India. People are not getting medical treatment because of the huge cost. Government has to do something about it," a bench comprising Justices Madan B Lokur, Kurian Joseph and Deepak Gupta said.

The top court's remark came as it asked the Centre whether any study has been conducted on the effects of air pollution on the health of people and the amounts spent on medical treatment of such ailments.

Additional solicitor general A N S Nadkarni, appearing for the Centre, informed the bench that some study on the impact of air pollution on the health of people has been conducted while some studies on the issue were going on.

Centre sanctions special monetary grant to ED

PRESS TRUST OF INDIA New Delhi, March 8

IN A BOOST to the Enforcement Directorate (ED), the government on Wednesday sanctioned a special monetary allowance for it, akin to what is granted to the investigators and employees of the premier probe agency — the CBI.

The Union finance ministry issued an order granting a 'special incentive allowance' at the rate of 20% of the basic pay, on par with the CBI, to the officers and staffers of the ED. ED director Karnal Singh

had, last year, written to the ministry seeking the special grant for the agency, given the task rendered by its sleuths of investigating some of the most complex and high-profile economic fraud and black money cases. The special incentive will not only act as a motivation for ED officers to work hard, a senior officer said, it will also attract good talent from other organisations who send their personnel on deputation to the agency.

The ED is tasked with enforcing two major laws — the Prevention of Money Laundering Act (PMLA) and the Foreign Exchange Management Act (FEMA) — in the country.

RELIANCE

*As reduced by the amount of applicable statutory levy.

MUTUAL

Wealth Sals You Free

Sd/-

RELIANCE NIPPON LIFE ASSET MANAGEMENT LIMITED (formerly Reliance Capital Asset Management Limited)

Tel No. +91 022 3303 1000 • Fax No. +91 022 3303 7662 • www.reliancemutual.com

NOTICE NO. 190

(CIN - L65910MH1995PLC220793)

Registered Office: Reliance Centre, 7th Floor, South Wing, Off Western Express Highway, Santacruz (East), Mumbai - 400 055.

Record Date March 14, 2018

DIVIDEND DECLARATION Notice is hereby given that the Trustee of Reliance Mutual Fund ("RMF") has approved declaration of dividend on the face value of Rs.10/- per unit in the undernoted Scheme of RMF, with March 14, 2018 as the record date:

| Name of the Scheme | Dividend (₹ per unit)* | NAV as on March 07, 2018 (₹ per unit) |
|--|---------------------------|--|
| Reliance Tax Saver (ELSS) Fund - Dividend Plan | 0.6000 | 22.0233 |
| Reliance Tax Saver (ELSS) Fund - Direct Plan - Dividend Plan | 0.0000 | 26.5680 |

Pursuant to payment of dividend, the NAV of the Scheme will fall to the extent of payout, and statutory levy, if any. The dividend payout will be to the extent of above mentioned dividend per unit or to the extent of available distributable surplus, as on the Record Date mentioned above, whichever is lower

For units in demat form: Dividend will be paid to those Unit holders/Beneficial Owners whose names appear in the statement of beneficial owners maintained by the Depositories under dividend option of the Scheme as on record date. All Unit holders under the Dividend Option of the above mentioned Scheme, whose names appear on the register of unit holders on the aforesaid record date, will be entitled to receive the dividend.

> For RELIANCE NIPPON LIFE ASSET MANAGEMENT LIMITED (formerly Reliance Capital Asset Management Limited)

(Asset Management Company for RELIANCE MUTUAL FUND)

Authorised Signatory

Reliance SIP is the facility offered to help investors to invest regularly in the select scheme of Reliance Mutual Fund. As with the investment in securities, the NAV of the units issued under the scheme can fluctuate as per factors affecting capital markets.

Start a Reliance SIP. Start a good habit today.

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

AICIC! ICICI Prudential Asset Management Company Limited PRUDENTIAL Corporate Identity Number: U99999DL1993PLC054135 MUTUAL FUND

Corporate Office: One BKC 13th Floor, Bandra Kurla Complex, Mumbai 400051. Tel: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100, website: www.icicipruamc.com, email id: enquiry@icicipruamc.com

Registered Office: 12th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001.

Central Service Office: 2nd Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express Highway, Goregaon (E), Mumbai - 400063. Tel: 022 2685 2000 Fax: 022 26868313

Notice to the Investors/Unit holders of ICICI Prudential Long Term Equity Fund (Tax Saving) and ICICI Prudential Dynamic Plan (the Schemes)

Notice is hereby given to all the investors/unit holders of the Schemes that March 14, 2018* has been approved as the record date for declaration of the following dividend under the Schemes. Accordingly, dividend will be paid to all the unit holders/ beneficial owners whose names appear in the register of unit holders/Statement of beneficial owners maintained by the Depositories, as applicable under the dividend option of the Schemes, at the close of business hours on the record date.

| Plans/Options under the Schemes | Rate of dividend (₹ Per unit) (Face value of ₹10/- each) \$ | NAV as on March 07, 2018 (₹ Per unit) |
|-------------------------------------|--|---|
| ICICI Prudential Long Term Equity F | und (Tax Saving) | |
| Dividend | 0.70 | 22.96 |
| Direct Plan - Dividend | 0.70 | 30.33 |
| ICICI Prudential Dynamic Plan | | |
| Dividend | 0.2400 | 22.9553 |
| Direct Plan - Dividend | 0,2000 | 27,1637 |

\$ The dividend payout will be subject to the availability of distributable surplus and may be lower depending upon the extent of distributable surplus available on the record date under the respective Schemes.


* or the immediately following Business Day, if that day is a Non-Business Day,

It should be noted that pursuant to payment of dividend, the NAV of the dividend option of the respective Schemes would fall to the extent of dividend payout and statutory levy, if any.

Investors are requested to take a note of the above. For ICICI Prudential Asset Management Company Limited

Place: Mumbai Date : March 08, 2018 Authorised Signatory No. 011/03/2018

CALL MTNL/BSNL: 1800 222 999 • Others: 1800 200 6666 • Or, apply online at www.icicipruamc.com Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



Bed. NET NAV. WYSTOCLAR VICINITY/COS. (TARRESCOVE) HAWY 42 AL 07 07 2016 INVAVA. tti Mily tewenager sit 13.02,2018. The key dizes siftly above NC and trovos iscensiv (1) Big submission and data & store: [4.63:2018 jag to [4.60 Mr.L.: (2) Big species min (Fart- Technology and T6.63.2018 of 15:00 her, and (3) fix opyoing pair that it Prov. Station concerning late. At other transport political of the size AT will recon an example largery to the control of the formation of the https://whitemiers.gov.in and letters I were subcould be

महानगर टेलीफोन निगम लिमिटेड खुशींद लाल भवन, जनपथ, नई दिल्ली-110050

निविदा आमंत्रण सूचना

मिटीएनएल, नई दिल्ली की ऑर से निष्निलिखित कार्यों हेश निधिवाएँ आमंत्रित की जाती हैं: सं ईंड (ई)-गी/सीई (ई)/2017-18/07 प्रथम तल कार-2 टीई विविदंग लोधी रोठ, नई दिल्ली पर 4x11 टीआर एयर कुल्ड टाईप एली युनिटों के एसआईटीसी तथा अन्य सर्वान्धत कार्य हेतु ऑनलाईन नितिदार्य आमजित की जाती है (अनुमारि लागत ! रु. 51,74,650/-)।

2. सं. इंड् (इ) रोहिणी/एमटीएनएल/एनआइंटी/2017-18/18 इंड् (ई) रोहिणी, दिल्ली ने अंतर्गत आरएसयू विल्डिंग, सैक्टर-6, रोहिणी, दिन्ली केंट तथा अन्य आरएसय रिधत एसी युनिटों के व्यापक रख-रखाव हेत् ऑनलाईन मद दर निविदारों आमंत्रित की जाती है (अनुमानित लगत है 22,40,400/-)।

3. सं. 27/इंड (सिविल) सीजीओ/एमटीएनएल/एनआईटी/2017-18 ईई (सिविल) सीजीओ द्वारा 9 एमडीएसएस बिल्डिंग, सीजीओ कॉम्प्लैक्स, लोबी शेंड, नई दिल्ली पर 1000 लीटर प्रति घंटा क्षमता के रिवर्स ऑसमोसिस सिस्टम की आपूर्ति, संस्थापना, परीक्षण तथा प्रारंभ करने हेत् ऑनलाईन मद दर निविदाय (दो बोली प्रणाली) (चतुर्थ कॉल) आमंत्रित की जाती है (अनुमानित लागत: रू. 4.02.744/-)।

4. सं. ईई (हैं) पी/सीई (हैं)/2017-18/8 टी.ई. बिल्डिंग, एमटीएनएल. लोधी रोड. नई दिल्ली स्थित फायर अलामे, फायर हिटेवशन तथा फायर फाईटिंग सिस्टम के उन्नयन हेत् ऑनलाईन निविदायें आमंत्रित की जाती हैं (अनुमानित लागत : रु. 53.29.254/-)।

5. स. एजीएम (एमपीएल)/10 पंयर मॉडयूल्स, लीटी बॉक्स एवं डीपी बॉक्स/ 2017-18/02 10 पेयर बीपी मोडयल्स (डिसकसशेन टाइप), सीटी बॉक्स 100 पेयर (डिसकसर्शन टाइप) तथा डीपी बॉक्स 10 पेयर एक्सटर्नेल (भारा-ए तकनीकी-वाणिज्यिक बोली तथा भाग वी विशीय बोली) की आवर्ति हेतु ऑनलाईन निविदाय आसंत्रित की जाती हैं (अनुमानित लागत : रु. 91:30 लाख)।

 स. ईई (ई) कंबीएन/एमटीएनएल/17-18/172 आरएसग्, एमटीएनएल, शास्त्री भवन, नई दिल्ली पर एयर कडीशनिंग सिस्टम के प्रावधान हेतू ऑनलाइन निविदारों आमंत्रित की जाती हैं (अनुमानित लागत - रु. 36.60.140/-)।

7. सं सीनियर मैमेजर (टीएक्स-एमएम)/ऑदरहेड ओ,एफ कंबल एसआईटीसीएम/ 2017 18/13 'ओयरहैंब ऑप्टिकल फाइबर कंबल (6F) बिछाने तेतु ठेकेंदारों की नियुक्ति एमटीएनएल दिल्ली के न्यायाधिकार क्षेत्र में 5 बर्ष की अवधि हेतु आपूर्ति, संस्थापना परीक्षण, प्रारंभन तथा रख-रखाव' हेत् ऑनलाइन निविदाएँ आमंत्रित की जाती है (अनुमानित लागत : ७. 3,30,40,000/-) ।

ऑनलाइन निर्विदाओं हेत् ई-प्रोक्यारमेंट वेंबसाइट : https://www.tcil-indiaelectronictender.com एवं http://www.eprocure.gov.in देखें । विस्तृत जानकारी हेतु हमारी वेबसाइट : http://etender.mini.net.in तथा

http://www.tenders.gov.in देखें। पारदर्शिता ही हमारी पहचान है!

Ahmedabad

BHAROSA APNO KA **HDFC Asset Management Company Limited** A Joint Venture with Standard Life Investments CIN: U65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676 Fax: 022 22821144 • e-mail: cliser@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

Launch of Plan under HDFC Fixed Maturity Plans - Series 39

NOTICE is hereby given that the New Fund Offer (NFO) of the following Plan under HDFC Fixed Maturity Plans - Series 39 (a close-ended income scheme), will open and close for subscription as under:

Name of Plan **NFO Opening Date** NFO Closing Date HDFC FMP 1147D March 2018 (1) March 15, 2018 March 20, 2018

Investors may note that the units of the above-mentioned Plan will be listed on the Stock Exchange(s) as mentioned in the Scheme Information Document where they can purchase / sell units on a continuous basis.

For HDFC Asset Management Company Limited

Place: Mumbai Sd/-Date: March 08, 2018 Chief Compliance Officer

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

CANARA ROBECO

Canara Robeco Mutual Fund

Investment Manager: Canara Robeco Asset Management Co. Ltd. Construction House, 4th Floor, 5, Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400 001. Tel.: 6658 5000 Fax: 6658 5012/13 www.canararobeco.com CIN No.: U65990MH1993PLC071003

NOTICE - CUM - ADDENDUM

All the Unit holders of Canara Robeco Mutual Fund are requested to take note of the following changes:

1. Changes in the Key Personnel of Canara Robeco Asset Management Company Ltd:

Ms. Cheenu Gupta is appointed as 'Fund Manager - Equities' of Canara Robeco Asset Management Company Limited with effect from 1st March, 2018. Her details are as follows:

| Name | Age/Qualification | Brief Experience |
|---------------------|---|---|
| Ms. Cheenu Gupta | 37/CFA Charter holder (USA), PGDBM (Finance) and B.E. (I.T) | Total experience - 12 years Details: Fund Manager - Equity - Tata AIA Life Insurance Company (August 2009 to February 2018) Senior Research Analyst - ING Investment Management (September 2007 to August 2009) Research Analyst - UTI Asset Management Company Ltd. (May 2006 to September 2007) |

Consequent to her appointment, the following scheme will be managed by Ms. Cheenu Gupta with effect from 12th March, 2018:

| Scheme Name | Existing Fund Manager | New Fund Manager | |
|--------------------------------|--|------------------|--|
| Canara Robeco Equity Tax Saver | Mr. Yogesh Patil and Mr. Ravi Gopalakrishnan | Ms. Cheenu Gupta | |

Change in the Fund Management responsibilities of Canara Robeco Mutual Fund ("CRMF") Schemes:

Pursuant to the resignation of Mr. Kartik Mehta (Fund Manager - Equities), all references to Mr. Kartik Mehta in the Statement of Additional Information ("SAI"), Scheme information Document ("SID") and Key Information Memorandum ("KIM") of the Schemes of Canara Robeco Mutual Fund stand deleted.

Consequently, the Fund Management responsibilities of the schemes managed by Mr. Kartik Mehta are allocated as follows: Calcar

| Scheme Name | Existing Fund Manager | New Fund Manager |
|---|---|--|
| Canara Robeco Emerging Equities | Mr. Ravi Gopalakrishnan and Mr. Kartik Mehta | Mr. Ravi Gopalakrishnan |
| Canara Robeco Capital Protection Oriented Fund - Series 6 | Mr. Ravi Gopalakrishnan, Mr. Kartik Mehta and Ms. Suman Prasad | Mr. Ravi Gopalakrishnan and Ms. Suman Prasad |
| | Mr. Kartik Mehta and Ms. Suman Prasad e ahove Schemes remain unchanged. Thi | |

integral part of the SAI/SID/KIM of the Scheme(s) of Canara Robeco Mutual Fund as amended from time to time. For and on behalf of Canara Robeco Asset Management Company Ltd.

(Investment manager for Canara Robeco Mutual Fund) Date: 08-03-2018

Place: Mumbai **Authorised Signatory** Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

I HDFC MUTUAL FUND

BHAROSA APNO KA

MUTUAL

Mumbai

March 08, 2018

HDFC Asset Management Company Limited A Joint Venture with Standard Life Investments

CIN: U65991MH1999PLC123027 Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676 Fax: 022 22821144 • e-mail: cliser@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

ADDENDUM to the Statement of Additional Information dated June 29, 2017 UPDATE ON INFORMATION ABOUT STANDARD LIFE INVESTMENTS LIMITED. CO-SPONSOR OF HDFC MUTUAL FUND

Investors are requested to take note of following update about the "Standard Life Investments Limited, Co-Sponsor ("SLIL") of HDFC Mutual Fund (the "Fund").

Merger of Standard Life plc and Aberdeen Asset Management PLC

In 2017, Standard Life plc merged with Aberdeen Asset Management PLC forming the Standard Life Aberdeen Group. On completion of the merger, Standard Life Investments Limited ("SLIL") remains a wholly owned subsidiary of Standard Life Investments (Holdings) Limited ("Hold Co."), which in turn is a wholly owned subsidiary of Standard Life Aberdeen plc, the ultimate parent of the Standard Life Aberdeen Group. The Securities and Exchange Board of India ("SEBI") vide its letter no. IMD/DF3/ OW/P/2018/4579 dated February 12, 2018 took note of the same

Investors are requested to take note that pursuant to the said merger:

- There will be no direct or indirect change in control of HDFC Asset Management Company Limited ("HDFC AMC"):
- There will be no change in the shareholding of HDFC AMC, SLIL, or the Hold. Co.; There will be no change in the board composition of HDFC AMC, SLIL, or the Hold. Co.;
- The will be no change in the Sponsors of the Fund; and
- There will be no change in the name of the Fund and/or the scheme(s) offered by the Fund;

In view of the above, the information about Standard Life Investments Limited, Co-Sponsor of the Fund appearing in "Sponsors" under section "Information about Sponsor, Asset Management Company and Trustee Company" of the Statement of Additional Information ("SAI") of the Fund shall stand replaced and updated as under:

"STANDARD LIFE INVESTMENTS LIMITED

Standard Life Assurance Company ("Standard Life") was, founded in 1825 and present in the Indian life insurance market from 1847 to 1938 when agencies were set up in Kolkata and Mumbai. Standard Life re-entered the Indian market in 1995, launching an insurance joint venture with HDFC.

In 1998, Standard Life Investments launched as a separate company, rapidly becoming a leading

global asset manager. In 2017, Standard Life merged with Aberdeen Asset Management forming the Standard Life Aberdeen Group. Standard Life Aberdeen is one of the world's largest investment companies, dedicated to creating

long-term value for clients and shareholders.

On completion of the merger, Standard Life Investments Limited remains a wholly owned subsidiary of Standard Life Investments (Holdings) Limited, which in turn is a wholly owned subsidiary of Standard Life Aberdeen plc, the ultimate parent of the Standard Life Aberdeen Group.

While retaining distinct investment philosophies and processes, Standard Life Investments and Aberdeen Asset Management share a set of common investment beliefs. The combined investment business has a substantial global presence with clients across 80 countries and £575.7bn assets under management*. It manages a diverse portfolio covering all major markets world-wide, including a range of private and public equities, government and company bonds, property investments and various derivative instruments. For more information log on to www.aberdeenstandard.com

*AUM of Aberdeen Standard Investments based on a Pro forma basis as at 31 December 2017."

All other contents of the SAI of the Fund will remain unchanged.

Place: Mumbai

This addendum shall form an integral part of the SAI of the Fund as amended from time to time.

For **HDFC Asset Management Company Limited**

Chief Compliance Officer Date: March 8, 2018

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS. READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

FRIDAY, MARCH 9, 2018 18 NATION

Suspense Account.

Place Mumbai

RELIANCE

DIVIDEND DECLARATION

Reliance Tax Saver (ELSS) Fund - Dividend Plan

*As reduced by the amount of applicable statutory levy.

Name of the Scheme

Reliance Tax Saver (ELSS) Fund - Direct Plan - Dividend Plan

unit holders on the aforesaid record date, will be entitled to receive the dividend.

WWW.FINANCIALEXPRESS.COM **FINANCIAL EXPRESS**

Sun Pharmaceutical Industries Limited Regd, Office: SPARC, Tandalja, Vadodara - 390012, Gujarat, INDIA. Goregaon (E), Mumbal - 400063 PHARMA

Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Tel: +91 22 4324 4324 CIN: L24230GJ1993PLC019050 Website: www.sunpharma.com

NOTICE Transfer of Equity Shares and unclaimed dividend to Investor Education and Protection Fund (IEPF)

Notice is hereby given that pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 notified by the Ministry of Corporate Affairs effective September 7, 2016 and as amended from time to time thereafter ("the Rules").

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares, in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, to the Investor Education and Protection Fund Suspense Account ("the IEPF Suspense Account")

Pursuant to the provisions set out in the Rules, the Company has communicated through individual notice(s), to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Suspense Account under the said Rules for laking appropriate action(s).

Erstwhile Ranbaxy Laboratories Limited ("Ranbaxy") had been merged with Sun Pharmaceutical Industries Limited ("the Company") w.e.f. 24" March, 2015 through a Scheme of Merger ("Scheme") as approved by the Hon'ble High Court of Punjab & Haryana and Hon'ble High Court of Gujarat. Pursuant to the Scheme, shareholders of erstwhile Ranbaxy were issued shares of the Company in accordance with the ratio prescribed in the Scheme. Out of the above shares, the shares on which dividend has not been paid or claimed for seven consecutive years or more, are now liable to be transferred to the IEPF Suspense Account.

The Company has uploaded full details of such shares which are due for transfer to IEPF Suspense Account on its website at http://www.sunpharma.com/investors/shareholders-information/details-of-shares-to-iepf, and the shareholders are requested to verify the details of the shares liable to be transferred to IEPF Suspense Account.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Suspense Account, may note that, as per the requirement of the Rules, the Company would be issuing duplicate share certificate(s) in fleu of the original share certificate(s) which are registered in their name and these original share certificate(s) will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be regarded and shall be deemed to be adequate notice in respect of issue of the duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Suspense Account pursuant to the Rules.

In case the Company does not receive any communication from the concerned shareholders by May 8, 2018, the Company, with a view to comply with the requirements set out in Rules, shall transfer the shares and unclaimed dividend (declared on May 16, 2011 by erstwhile Ranbaxy) to the IEPF Suspense Account by the due dates as per procedure stipulated in the Rules.

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to IEPF Authority/ IEPF Suspense Account including all the benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority/ IEPF Suspense Account, after following the procedure as prescribed under the Rules. In case the shareholders have any queries on the subject matter, they may contact the Company's Registrar and

Share Transfer Agent - Link Intime India Pvt. Ltd., C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli West, Mumbai - 400 083, Tel No.: (022) 49186270, E-mail: rnt.helpdesk@linkintime.co.in.

By order of the Board of Directors For Sun Pharmaceutical Industries Ltd.

Date : March 6, 2018

MUTUAL

FUND

Ashok I. Bhuta Compliance Officer

RELIANCE NIPPON LIFE ASSET MANAGEMENT LIMITED

(formerly Reliance Capital Asset Management Limited)

(CIN - L65910MH1995PLC220793)

Registered Office: Reliance Centre, 7th Floor, South Wing, Off Western Express Highway, Santacruz (East), Mumbai - 400 055.

Tel No. +91 022 3303 1000 • Fax No. +91 022 3303 7662 • www.reliancemutual.com

NOTICE NO. 190

Notice is hereby given that the Trustee of Reliance Mutual Fund ("RMF") has approved declaration of dividend on the

Pursuant to payment of dividend, the NAV of the Scheme will fall to the extent of payout, and

statutory levy, if any. The dividend payout will be to the extent of above mentioned dividend per unit or to the

For units in demat form: Dividend will be paid to those Unit holders/Beneficial Owners whose names appear in the

statement of beneficial owners maintained by the Depositories under dividend option of the Scheme as on record date.

All Unit holders under the Dividend Option of the above mentioned Scheme, whose names appear on the register of

face value of Rs.10/- per unit in the undernoted Scheme of RMF, with March 14, 2018 as the record date:

extent of available distributable surplus, as on the Record Date mentioned above, whichever is lower

SC questions govt on 'exorbitant' medical treatment

PRESS TRUST OF INDIA New Delhi, March 8

THE 'EXORBITANT' COST of medical treatment in India drew attention of the Supreme Court on Wednesday and it asked the government to 'do something' as the people were unable to get

treatment due to the 'huge cost'.

The apex court's remarks assume significance as the National Pharmaceutical Pricing Authority (NPPA) had recently said that non-scheduled drugs and diagnostic services constituted major components of charges billed to patients in four private hospitals in Delhi and national capital region (NCR) with margins as high as 1,192%.

As per an analysis done by the NPPA, the margin on procurement price of drugs used in emergency cases for treatment of potentially lifethreatening low blood pressure was 1,192%. The drug pricing regulator had recently

Wealth Sets You Free

Record Date

March 14, 2018

NAV as on March

07, 2018 (₹ per unit)

22.0233

26.5680

Dividend

(₹ per unit)*

0.6000

said that in case of Adrenor 2 ml injection with an MRP of ₹189.95, the purchase price for the hospitals was ₹14.70 but the patients were being charged ₹5,318.60, including taxes.

"The cost of medical treatment is exorbitant in India. People are not getting medical treatment because of the huge cost. Government has to do something about it," a bench comprising Justices Madan B Lokur, Kurian Joseph and Deepak Gupta said.

The top court's remark came as it asked the Centre whether any study has been conducted on the effects of air pollution on the health of people and the amounts spent on medical treatment of such ailments.

Additional solicitor general A N S Nadkarni, appearing for the Centre, informed the bench that some study on the impact of air pollution on the health of people has been conducted while some studies on the issue were going on.

Centre sanctions special monetary grant to ED

PRESS TRUST OF INDIA New Delhi, March 8

IN A BOOST to the Enforcement Directorate (ED), the government on Wednesday sanctioned a special monetary allowance for it, akin to what is granted to the investigators and employees of the premier probe agency — the CBI.

The Union finance ministry issued an order granting a 'special incentive allowance' at the rate of 20% of the basic pay, on par with the CBI, to the officers and staffers of the ED.

ED director Karnal Singh had, last year, written to the ministry seeking the special grant for the agency, given the task rendered by its sleuths of investigating some of the most complex and high-profile economic fraud and black money cases. The special incentive will not only act as a motivation for ED officers to work hard, a senior officer said, it will also attract good talent from other organisations who send their personnel on deputation to the agency.

The ED is tasked with enforcing two major laws — the Prevention of Money Laundering Act (PMLA) and the Foreign Exchange Management Act (FEMA) — in the country.

Authorised Signatory Start a Reliance SIP. Start a good habit today.

investment in securities, the NAV of the units issued under the scheme can fluctuate as per factors affecting capital markets.

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Reliance SIP is the facility offered to help investors to invest regularly in the select scheme of Reliance Mutual Fund. As with the

ICICI ICICI Prudential Asset Management Company Limited PRLDENTIALT Corporate Identity Number: U99999DL1993PLC054135 MUTUAL FUND

Registered Office: 12th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001. Corporate Office: One BKC 13th Floor, Bandra Kurla Complex, Mumbai - 400051. Tel: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100, website: www.icicipruamc.com, email id: enquiry@icicipruamc.com Central Service Office: 2nd Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express Highway,

Goregaon (E), Mumbai - 400063. Tel: 022 2685 2000 Fax: 022 26868313 Notice to the Investors/Unit holders of ICICI Prudential Long Term Equity Fund

(Tax Saving) and ICICI Prudential Dynamic Plan (the Schemes) Notice is hereby given to all the investors/unit holders of the Schemes that

March 14, 2018* has been approved as the record date for declaration of the following dividend under the Schemes. Accordingly, dividend will be paid to all the unit holders/ beneficial owners whose names appear in the register of unit holders/Statement of beneficial owners maintained by the Depositories, as applicable under the dividend option of the Schemes, at the close of business hours on the record date. Plans/Options under the Schemes Rate of dividend NAV as on

(# Day unit)

March 07 2019

| | (Face value of ₹10/- each) \$ | (₹ Per unit) |
|--------------------------------|----------------------------------|--------------|
| ICICI Prudential Long Term Equ | uity Fund (Tax Saving) | |
| Dividend | 0.70 | 22.96 |
| Direct Plan - Dividend | 0.70 | 30.33 |
| ICICI Prudential Dynamic Plan | | |
| Dividend | 0.2400 | 22.9553 |
| Direct Plan - Dividend | 0.2000 | 27.1637 |

may be lower depending upon the extent of distributable surplus available on the record date under the respective Schemes.

* or the immediately following Business Day, if that day is a Non-Business Day,

It should be noted that pursuant to payment of dividend, the NAV of the dividend option of the respective Schemes would fall to the extent of dividend payout and statutory levy, if any. Investors are requested to take a note of the above.

For ICICI Prudential Asset Management Company Limited Sd/-Place: Mumbai

Date : March 08, 2018 **Authorised Signatory** No. 011/03/2018

CALL MTNL/BSNL: 1800 222 999 • Others : 1800 200 6666 • Or, apply online at www.icicipruamc.com Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



For RELIANCE NIPPON LIFE ASSET MANAGEMENT LIMITED

(Asset Management Company for RELIANCE MUTUAL FUND)

(formerly Reliance Capital Asset Management Limited)

WEST BENGAL STATE ELECTRICITY DISTRIBUTION COMPANY LIMITED (A Govt, of West Bengal Enterprise)

is follows: (1) Bid submission and date & time: 14.03.2018 (up to 14.00 bes.); (2) Sid opening date (Part-1: fecting-commercial): 16,03,2018 at 15:00 hrs. and (3) Bid opening date (Fart-Iz Price); Shall be intimated later: All other terms and conditions of the above MT will remain unchanged. Interested hidden can download the documents from https://wbtenders.gov.in and https://www.wbsedcl.in ICA- T1760(6)/2018

खर्शीद लाल भवन, जनपथ, नई दिल्ली-110050

निविदा आमंत्रण सूचना एमटीएनएल नई दिवली की ओर से निम्निजियत कार्यी हंत निविदाएँ आमतित की जाती है:

1. य इंड (ई) पी/सीड (ई)/2017-18/07 प्रमा तल कार-2 टी इ विलिंबन लांभी रोज, नई दिल्ली पर 4x11 टीआर एयर कुल्ब टाईप एसी युनिटों के एसआईटीसी तथा अन्य संबन्धित काथं हेतु ऑनलाईन निविदायें आमंत्रित की जाती है (अनुमानित लागत क 51.74.660/-)। 2. सं इंदे (ई) राष्ट्रिणी/एमटीएनएल/एनआईटी/2017-18/18 ईई (ई) रोष्ट्रिणी, दिल्ली

के अंतर्गत आरएसच् बिन्डिंग, संबटर-६ शिहिणी, दिल्ली केंद्र तथा अन्य आरएसय् स्थित एसी यनियों के व्यापक रख-रखाव हेत ऑनलाइन गढ़ दर निविदार्थ आगंजित की जाती हैं (अनुसामित लागत : रु. 22,40,400/)। स. 27/ईई (सिविल) सीजीओ/एमटीएनएल/एनआईटी/2017-18 ईई (सिविल) सीजीओ द्वारा 9 एमडीएसएस बिल्डिंग, सीजीओ कॉम्ब्लेक्स, लोधी रोड, नई दिल्ली पर

1000 लीटर प्रति घंट। क्षमता के रिवर्स ऑसमोसिस शिस्टम की आपूर्ति, संख्यापना, प्रशेक्षण तथा प्रारंभ करन हेतु ऑनलाईन गद दर निविदाये (दो बोली प्रणाली) (चतुर्थ कॉल) आमंत्रित की जाती है (अनुमानित लागत 😗 4,02,744/-)। 4. स ईई (ई) पी/सीई (ई)/2017-18/8 टी ई बिल्डिंग, एमटीएनएल, लोघी रोड

नई दिल्ली स्थित फायर अलामें, कायर डिटेज्शन तथा कायर काईटिंग सिस्टम के उन्नयन हेतु ऑनलाईन निविदाये आमंत्रित की जाती है (अनुमानित लागत क 53.29.254/-)। स. एजीएम (एमपीएल)/10 प्रयर मॉड्यूल्स सीटी वॉक्स एवं डीपी बॉक्स/

2017-18/02 10 पेयर डोपी मॉडयून्स (डिसकसर्शन टाइप), सीटी यावस 100 पेयर (डिसकंसर्शन टाइप) तथा डीपीं बॉक्स 10 मेयर एक्सटर्नल (भाग-ए तकनीकी-वाणिज्यिक बोली तथा भाग बी वितीय बोली) की आधुर्ति हत ऑनलाईन निविदाय आमंत्रित की जाती हैं (अनुमानित जागत : रु 91,30 लाख)।

 सं ईई (ई) केबीएन/एमटीएनएल/17-18/172 आएएसयू, एमटीएनएल, शास्त्री भवन नई दिल्ली गर एवर कंडीशनिंग सिल्टम के प्रावधान इत् ऑनलाईन निविदायें आगंत्रित की जाती है (अनुमानित लागत क. 36.60,140/-)। 7. सं सीनियर मैंनजर (टीएक्स-एमएम)/ओक्स्इंड ओ.एक केंवल एसआईटीसीएम/

2017-18/13 'आपरहेंब ऑफ्टिकल फाइयर केंबल (6F) बिछाने हेत् ठकंदारों की नियुवित एमटीएनएल विल्ली क न्यायाधिकार क्षेत्र में 5 वर्ष की अवधि हेत आपूर्ति संस्थापना गरीक्षण, प्रारंभन तथा रख-रखाव" हेतु ओनलाइन निविदाएँ आमंत्रित की जाती है (अनुमानित लागत रु. ३,३०,४०,०००/-)। ऑनलाइन निविदाओं हेतु ई-प्रोक्यारगेंट वयसाइट : https://www.tcll-india-

विस्तृत जानकारी इत् हमारी वेंबसाइट : http://etender.mtnl.net.in तथा http://www.tenders.gov.in देखें।

electronictender.com एव http://www.eprocure.gov.in वेसे ।

पारदर्शिता ही हमारी पहचान है!

WEST BENGAL STATE ELECTRICITY

DISTRIBUTION COMPANY LIMITED (A Govt. of West Bengal Enterprise)

Regd. Office : Vidyut Bhavan, Block-DJ, Sector-II, Bidhar

WBSEDEL **EXTENSION OF TIME** Ref. NIT No.: WBSEDCL/RE/DDUGJY/SUB-STATION/2017-18/NIT-32 dt. 07.02.2018 originali published in this newspaper on 13.02.2018. The key dates of the above NIT are hereby extended as follows: (1) Bid submission end date & time; 14.03.2018 (up to 14:00 hrs.); (2) Bid opening date (Part-I: Techno-commercial): 16.03.2018 at 15:00 hrs. and (3) Bid opening date (Part-II: Price): Shall be intimated later. All other terms and conditions of the above NIT will remain unchanged. Interested bidders can download the documents from https://wbtenders.gov.in and https://www.wbsedcl.in ICA- T1760(6)/2018

દવા લોંચ માટે કરવા મેડિક્યોર ઇન્ટરનેશનલ સાથે જોડાણ કર્ય

કેડિલાએ

મેડિક્યોર

SUN

પીટીઆઇ નવી દિલ્હી, તા.૮

દવા કંપની ઝાયડસ આઇએનસીની કેડિલાએ યુએસ સ્થિત મેડિક્યો૨ ઇન્ટરનેશનલ આઇએનસી સાથે નિશ્ચયાત્મક કરાર કર્યા છે, જે તેની નવી પિટાવાસ્ટેટિન મેગ્નેસિયમને અમેરિકામાં કોમર્સિયલાઇઝ કરવાને લગતા ઝિપિટામેગ કે જેનો ઉપયોગ કોલેસ્ટોરલના સ્તરને યોગ્ય સ્તરે રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેનું અમેરિકામાં ઝાયડસ માટે પ્રથમ બ્રાન્ડેડ પ્રોડક્ટ લોન્ચ છે. કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કેડિલાએ જણાવ્યું હતું કે આ કરારના એક ભાગરૂપે, તે નવી એપ્લિકેશન (એનડીએ)જાળવી રાખશે અને મેડિક્યો૨ ઝિપિટામેગના વેચાણ અને માર્કેટિંગ માટે

એમએસઇડીસીએલ ઓક્શનમાં ટોરેન્ટ પાવરે ૧૨૪ મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટને મેળવ્યો પીટીઆઇ

નવી દિલ્હી, તા.૮

ટોરેન્ટ પાવરે આજે જણાવ્યું હતું કે વિન્ડ પાવર પ્રોજેક્ટ મેળવ્યો છે જેમાં ૧૨૪.૪ મેગાવોટ વીજળી મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યૂશન

કાું.લિમિટેડ(એમએસઇડીસીએ ોલ)ને પૂરી પાડવામાં આવશે. વિન્ડ પાવર પ્રોજેક્ટસ માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેકટ્રિસિટી ડિસ્ટિ%બ્યશન લિમિટેડ(એમએસઇડીસીએલ)દ્વારા યોજાયેલા રિવર્સ ઇ-ઓક્શન હેઠળ કંપની વિજેતા તરીકે ઊભરી આવી હતી, તેમ ટોરન્ટ પાવરે બીએસઇને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું.

ગઇકાલે આ હરાજી કરવામાં આવી હતી, જેમાં એમએસઇડીસીએલે ૫૦૦ મેગાવોટ વિન્ડ પાવર મેળવવા બિડર્સ પાસેથી મહારાષ્ટ્રમાં ૧૨૪.૪ મેગાવોટસ ક્ષમતા સ્થાપવા બિડસ મંગાવી હતી. જે એમએસઇડીસીએલને વીજળી પૂરી પાડી શકે.

પાવર પરચેઝ એગ્રીમેન્ટના અમલથી આ પ્રોજેક્ટ ૧૮ માસમાં સ્થાપવામાં આવશે.

નોટિસ

મદ્રાસ ખાતે ન્યાયાધીશોની હાઇકોર્ટમાં

(ઓર્ડિનરી ઓરીજીનલ સિવિલ જ્યરીડિક્શન) અરજી નં. ૨૦૧૭ ની ૬૯૭૬ બાર્બીટ્રેશન અને કોન્સિલિયેશન એક્ટ, ૧૯૯૬ની બાબ**ત**

યે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને કાઇનાન્સ કંપની લિ. **અ** શ્રી મેહુલભાઇ જગદિશભાઇ પોંકિયાનાં વિવાદ અને તારીખ ૨૦.૦૩.૨૦૧૩ તારીખનાં લોન કરાર નં. XSHUSRT00000930816 હેઠળ ઉદભવતા વિવાદની બાબતમાં

મે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ કંપની લિમિટે 'ડેરહાઉસ', નં. ૨ એન.એસ.સી. બોઝ રોડ, પેરીઝ, ચેન્નઇ- ૬૦૦૦૦૧.

તેનાં ઓથોરઆઝ્ડ સિગ્નેટરી દ્વારા પ્રસ્તુત : અરજદા

ની વિરૂદ્ધમાં . શ્રી મેહુલભાઇ જગદિશભાઇ પોંકિયા ૮૦૩, પ્રભાકર ટાવર-૭, રાજહંસ સ્વપ્ના. સરથાના જકાતનાકા સુરત, ગુજરાત-૩૯૫૦૦૬

શ્રી જગદિશભાઇ કે. પુંકિયા S/o. ખોડાભાઇ પોકિંયા ૮૦૩, પ્રભાકર ટાવર-૭, રાજહંસ સ્વપ્ના,

સરથાના જકાતનાકા, સુરત, ગુજરાત-૩૯૫૦૦૬

. શ્રી મેહુલભાઇ જગદિશભાઇ પોંકિયા

S/o. ૮૦૩, પ્રભાકર ટાવર-૭, રાજહંસ સ્વપ્ના, સરથાના જકાતનાકા,

સુરત, ગુજરાત-૩૯૫૦૦૬ શ્રી જગદિશભાઇ કે. પુંકિયા S/o. ખોડાભાઇ પોકિંયા

૮૦૩, પ્રભાકર ટાવર-૭, રાજહંસ સ્વપ્ના, સરથાના જકાતનાકા, સુરત, ગુજરાત-૩૯૫૦૦૬ . ઉપરોક્ત અરજીનાં સંદર્ભમાં માનનીય હાઇકોર્ટ, મદ્રા ૦૫.૦૩.૨૦૧૮ નાં રોજ ૨૦.૦૩.૨૦૧૮ નાં રોજ અથવ તે પહેલા ગ્રા. ૧૧.૩૫.૩૧૨.૯૮/-ની રકમનાં દાવાર્ન હદની સિક્યો રીટી પુરી પાડવા માટે આદેશ કર્યો હતો. ઉપરોક્ત અરજી માનનીય હાંઇકોર્ટ, મદ્રાસ સમક્ષ ૨૨.૦૩.૨૦૧૮ • રોજ મુકવામાં આવી છે. મહેરબાની કરીને નોંધ લેવી અ

વ્યક્તિગત અથવા એડવોકેટ મારફત હાજર રહેવું ચ

સિક્યોરીટી પુરી પાડવી.

મે. ડી. પ્રદિપ કમાર અરજદારનાં કાઉન્સિ

Place:Mumbai

Date: March 08, 2018

ઝાયડસે યુએસમાં કોલેસ્ટોરેલની ક્લીન એનર્જી પ્રોજેક્ટોમાં ઇઆઇબીની ભારત સાથે સમજૂતી

પર સહી કરશે." અત્રે એ એનર્જી પ્રોજેક્ટમાં મોટાપાયે ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટને

પીટીઆઇ

મેડિક્યોર

ઇન્ટરનેશનલ

આઇએનસી સાથે આ બાબતે કરાર

કર્યા છે. ઝિપિટામેગને એક એમજી.

૨ એમજી અને ૪ એમજી માટે

નવી દિલ્હી,તા.૮ (ઇઆઇબી)એ ભારતમાં નાના ઇન્ટરનેશલ જવાબદાર રહેશે. ઝયાડસ

અને મોટા કદના ક્લીન એનર્જીના એલાયન્સની ડિસેમ્બર ૧૧, પ્રોજેક્ટોમાં ધિરાણ કરવા માટે ૨૦૧૮માં જે બેઠક મળી રહી છે ભારત સાથે સમજૂતી કરી છે. તેમાં ભાગ લઇ રહી છે. દેશમાં ૮૦૦ મિલિયન યુરોના વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રોકાણનું તેનું આયોજન છે જેના પ્રમુખ એમેન્યુઅલ માર્કોને આ ભાગરૂપે આ સમજૂતી કરવામાં સમીટનું આયોજન એ ઉદેશ્યથી પેટાકંપની | આવી છે. એક યાદીમાં આ કર્યુ છે કે, ૧૨૧ જેટલા દેશોને માહિતી આપતા જણાવાયું છે કે, સોલાર એનર્જીનો લાભ લેવા "દસમી માર્ચના રોજ પ્રેસિડેન્ટ માટે સહયોગ અને ટેકનોલોજી

વર્નર હોયર સમગ્ર ભારતમાં હાથ શેરીંગ વગેરેની કાર્યવાહી કરી ધરવામાં આવનારા પ્રોજેક્ટમાં શકે.દરમિયાનમાં ઇઆઇબીનો દવા એપ્લિકેશન પ્રોડક્ટ મંજૂરી આપવામાં આવેલી છે. નવા ધિરાણો અંગેની સમજૂતી દાવો છે કે, દુનીયામાં તે ક્લીન Sun Pharmaceutical Industries Limited

> Goregaon (E), Mumbai - 400063 Tel: +91 22 4324 4324 CIN: L24230GJ1993PLC019050 Website: www.sunpharma.com

NOTICE Transfer of Equity Shares and unclaimed dividend to Investor Education and Protection Fund (IEPF

Regd. Office: SPARC, Tandalja, Vadodara - 390012, Gujarat, INDIA

Corporate Office: Sun House. Plot No. 201 B/1, Western Express Highway,

Notice is hereby given that pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 notified by the Ministry of Corporate Affairs effective September 7, 2016 and as amended from time to time thereafter ("the Rules").

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares, in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, to the Investor Education and Protection Fund Suspense Account ("the IEPF Suspense Account")

Pursuant to the provisions set out in the Rules, the Company has communicated through individual notice(s), to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Suspense Account under the said Rules for taking appropriate action(s).

Erstwhile Ranbaxy Laboratories Limited ("Ranbaxy") had been merged with Sun Pharmaceutical Industries Limited ("the Company") w.e.f. 24th March, 2015 through a Scheme of Merger ("Scheme") as approved by the Hon'ble High Court of Punjab & Haryana and Hon'ble High Court of Gujarat. Pursuant to the Scheme, shareholders of erstwhile Ranbaxy were issued shares of the Company in accordance with the ratio prescribed in the Scheme. Out of the above shares, the shares on which dividend has not been paid or claimed for sever consecutive years or more, are now liable to be transferred to the IEPF Suspense Account.

The Company has uploaded full details of such shares which are due for transfer to IEPF Suspense Account on its website at http://www.sunpharma.com/investors/shareholders-information/details-of-shares-to-iepf, and the shareholders are requested to verify the details of the shares liable to be transferred to IEPF Suspense Account.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Suspense Account, may note that, as per the requirement of the Rules, the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) which are registered in their name and these original share certificate(s) will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be regarded and shall be deemed to be adequate notice in respect of issue of the duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Suspense Account pursuant to the Rules.

In case the Company does not receive any communication from the concerned shareholders by May 8, 2018, the Company, with a view to comply with the requirements set out in Rules, shall transfer the shares and unclaimed dividend (declared on May 16, 2011 by erstwhile Ranbaxy) to the IEPF Suspense Account by the due dates as

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to IEPF Authority/ IEPF Suspense Account including all the benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority/ IEPF Suspense Account, after following the procedure as prescribed under the Rule

In case the shareholders have any queries on the subject matter, they may contact the Company's Registrar and Share Transfer Agent - Link Intime India Pvt. Ltd., C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli West, Mumbai – 400 083, Tel No.: (022) 49186270, E-mail: rnt.helpdesk@linkintime.co.in.

By order of the Board of Directors For Sun Pharmaceutical Industries Ltd.

Ashok I. Bhuta Place: Mumbai

> PUBLIC ANNOUNCEMENT, PURSUANT TO SEBI CIRCULAR NO. SEBI/HO/MRD/DSA/CIR/P/2016/110 DATED OCTOBER 10, 2016, FOR THE ATTENTION OF THE PUBLIC SHAREHOLDERS OF GLOBE SOYA PRODUCTS LIMITED

Regd. Off.: Flat No.: C-6, Krishnakunj Township, Narayanpur, P. O. Rajerhat Gopalpur, Kolkata-700136 Corp. Off.: 501, Ruby Palace, Cesar Road, Opp. Filmalaya Road, Andheri (W), Mumbai-400058 Contact No.: +91 8100095726; E-mail: globesoya@yahoo.com;

This Public Announcement ('PA') is being issued by Golden Medows Export Private Limited ('Acquirer'), being the Promoter of the Globe Soya Products Limited ('GSPL' / 'Company'), on behalf of itself and the Promoter and Promoter Group of GSPL of GSPL, in accordance with Circular No. SEBI/HO/MRD/DSA/CIR/P/2016/110 dated October 10, 2016 ("Exit Circular") issued by Securitie and Exchange Board of India ('SEBI') and the Checklist issued by BSE Limited, Mumbai ('BSE') for implementation of the Exit Circular in respect of the proposed Exit Offer.

(A) BACKGROUND:

a) GSPL, a company limited by shares, was incorporated on June 26, 1985, under the Companies Act, 1956 and received the Certificate for Commencement of Business on June 28, 1985. The Registered Office of the Company is situated at Flat No.: C-6, Krishna kun Township, Narayanpur, P. O. Rajerhat Gopalpur, Kolkata-700136 and the Corporate Office of the Company is situated at 501, Ruby Palace, Cesar Road, Opp. Filmalaya Road, Andheri (W), Mumbai-400058; The Company is, inter alia, engaged in the business of trading of securities. The paid up equity share capital of GSPL as on March 31, 2017 is Rs. 1050.00 Lakhs comprising of 1,05,00,000 equity shares of face value of Rs. 10/- each.

The Shareholding Pattern of the Company, as on March 31, 2017, is as under

| Category | No. of Shareholders | No. of Equity Shares | % of Equity Share Capital |
|---------------------------|---------------------|----------------------|---------------------------|
| Promoter & Promoter Group | 17 | 97,04,950 | 92.43 |
| Public | 535 | 7,95,050 | 7.57 |
| Total | 552 | 1,05,00,000 | 100.00 |

c) The Key Financial Information of the Company, based on the financial statements for the Financial Year(s) ended March 31, 2017, Marc 31, 2016 and March 31, 2015, is as under: (Amount in Rs. Lakhs except earnings per share data)

| Particulars | Mar-2015 Judited | 31-Mar-2016 Audited | 31-Mar-2017 Audited |
|---------------------------------|-------------------------|------------------------|------------------------|
| Total Revenue | 32.01 | 31.62 | 200.49 |
| Profit / (Loss) After Tax | (6.46) | (17.13) | (38.16) |
| Earnings Per Share (Rs.) | (0.06) | (0.16) | (0.36) |
| Net Worth / Shareholders' Funds | 1014.24 | 997.10 | 958.93 |
| Book Value per Share (Rs.) | 9.7 | 9.49 | 9.13 |

- d) The equity shares of GSPL were listed on the Delhi Stock Exchange Limited, New Delhi ('DSE'). SEBI, vide its Order No. WTM/PS/45 MRD/DSA/NOV/2014 dated November 19, 2014, had withdrawn the recognition granted to DSE as a Stock Exchange. Subsequently SEBI, vide its Order No. WTM/SR/SEBI/MRD-DSA/04/01/2017 dated January 23, 2017 has allowed the exit of DSE as a stock exchange. Pursuant to the de-recognition/exit of DSE, the equity shares have been placed on Dissemination Board of BSE Limited, Mumbai ('BSE') The Company, in terms of applicable provisions of Exit Circular, expressed its intention to provide an exit opportunity to the public
- shareholders of GSPL and the company has submitted the 'Plan of Action' to BSE on March 27, 2017 The Acquirer now seeks to acquire 7,95,050 equity shares of face value of Rs. 10/- each representing 7.57% of the paid-up equity share capital of the Company from the Public Shareholders of GSPL. Subsequent to the completion of the process, GSPL shall make an
- application to BSE for removal of its name from the Dissemination Board of BSE. This PA is being issued in terms of the Exit Circular and shall be published in Financial Express (All Editions)-being the English Nationa Daily and Jansatta (All Editions) - Hindi being the regional language newspaper of the region where the exited stock exchange (DSE)
- was located and Kalantar- Bengali being the regional newspaper of Kolkata where the registered office of the Company is located. The Acquirer will inform the Public Shareholders, by way of a notice in the same newspapers in which the present PA is published, of
- material changes, if any, to the information set out in this PA. (B) EXIT OFFER PRICE AND JUSTIFICATION:
- The Company has appointed Ashika Capital Limited ('Ashika') a Category I Merchant Banker registered with Securities and Exchange Board of India ('SEBI') and an Independent Valuer empanelled with BSE as the Independent Valuer to carry out valuation exercise and determine the fair value of the equity shares of the Company.
- In terms of Valuation Report dated November 13, 2017, issued by Ashika, after taking into consideration the applicable valuation method or approach, the fair value of the equity share of face value of Rs. 10/- each of the Company works out to Rs. 9.13/-. The said Valuatio Report will be available for inspection at the Registered Office of the Company during office hours for a period of ten days from the date of this Public Announcement.

(C) ACTIVITY SCHEDULE FOR EXIT OFFFR-

| THE DELE FOR EATH OFFER. | | | | |
|--------------------------|--|----------------------------|--|--|
| | Date of Opening of Offer | March 19, 2018 (Monday) | | |
| | Date of Closing of Offer | March 26, 2018 (Monday) | | |
| | Last Date for Payment of Consideration | April 18, 2018 (Wednesday) | | |

(D) PROCEDURE FOR SETTLEMENT:

a) The Fxit Offer Letter along with the Acceptance Form and Form SH 4 - Securities Transfer Form is being dispatched to all the public shareholders of the Company, whose names are appearing on the Register of Members of the Company on March 09, 2018

In case of non receipt of the Exit Offer Letter, such shareholders of the Company may download the same from the BSE's website i.e www.bseindia.com or obtain a copy of the same from the Company on providing suitable documentary evidence of holding of the Equity

During the Offering period, all the public shareholders of the Company, may tender their shares by submitting the Acceptance Form, Forn SH 4 - Securities Transfer Form duly executed, Original Share Certificate(s) and other relevant documents

1) The payment for equity shares accepted under the exit offer will be made within fifteen (15) working days from the date of completion of exit offer by way of Pay Order / Demand Draft / Real Time Gross Settlement (RTGS) / National Electronic Funds Transfer (NEFT', Immediate Payment Service (IMPS') or any other permitted mode of transfer. The pay order/demand draft shall be drawn in favour or sole or first named shareholder (in case of joint holders) and will be dispatched to the shareholder(s) by Registered Post/ Speed Post The Company shall certify to the satisfaction of BSE that appropriate procedure has been followed for providing exit to public shareholders of the Company. Subsequently, BSE upon satisfaction shall remove the company from the dissemination board

(E) LIABILITY OF THE ACQUIRER: a) The Acquirer, on behalf of itself and other entities forming part of the Promoter and Promoter Group of GSPL, is liable to acquire the shares of Public Shareholders who have not offered their shares under exit offer up to a period of one (1) year from the completion of the Offer at the same price as determined by the Independent Valuer.

Further, the Company undertakes to redress the grievances of all the public shareholders pursuant to the removal of the name of the company from the said Dissemination Board. This Public Announcement is issued for information of the Public Shareholders of the Company. This Public Announcement is expected o be available on website of BSE at www.bseindia.com.This Public Announcement is issued on behalf of the Board of Directors of the

For Golden Medows Exports Limited

DIN:05142395

આપવામાં નહિં આવે.

ઉદ્ઘેખનીય છે કે, યુરોપીઅન ધિરાણની કામગીરી કરનારી ધિરાણ કર્યુ હતું. જે તેના કુલ યુરોપીયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ઇનવેસ્ટમેન્ટ બેંક દિલ્હી ખાતે બેંક છે. વર્ષ ૨૦૧૭માં ધિરાણ કામકાજનું ૨૮ટકા થાય સોલાર ઇઆઇબીએ ૧૯.૬ બિલિયનનું છે.

BHARAT SANCHAR NIGAM LIMITED **BSNL** O/o Chief General Manager, Maharashtra Telecom Circle, BSNL, Admin. Complex, 1st Floor, D Wing, Juhu Road, Santacruz (W),Mumbai –400 054 NOTICE INVITING TENDER Digitally Sealed EOI is invited by CGM, BSNL, Maharashtra Telecom Circle, Mumbai-54 from the

prospective bidders for the following Estimated cost in Rs Name of the Item/work Providing Last Mile RF Connectivity with Maintenance and on All India Link Management with or without SLA to BSNL customers basis for 3 years Last date of receipt of tender is 02.04.2018 at 12.00 Hrs.

(Tender ID: 2018_BSNL_315511 _1) For further details please visit website: www.eprocure.gov.in or Contact AGM (CPC-I) or PH-022-26467761/26467006; E-mail ID: agmr

बीईएमएल लिमिटेड BEML LIMITED भारत सरकार का उपक्रम) (A Govt. of India Undertaking)

CIN: L35202KA1964GOI001530
Registered Office: "BEML SOUDHA", 23/1, 4th Main Road, S.R. Nagar, Bengaluru - 560 027. Tel. & Fax: (080) 22963142, E-mail: cs@beml.co.in, Website: www.bemlindia.com

NOTICE

Notice is hereby given that the following share certificate has been reported lost/ misplaced and the holder of the share certificate has applied with the Company for issue

| apricate share certificate. | | | | | |
|-----------------------------|-----------|-------------|-----------------|-------------------|--|
| Name of Shareholder | Folio No. | Cert No. | No of Shares | Distinctive Nos. | |
| Mahesh Chamadiya | BES017688 | 78659 | 100 | 33865801-33865900 | |

Objections, if any, may please be lodged with the Company at the above address within 15 days from the date of publication of this notice. Please note that, if no objection is received within the said period, the Company will proceed further with ssuing the duplicate share certificate to the applicant/shareholder

For BEML LIMITED 08.03.2018 (SV Ravisekhar Rao)

***RELIGARE** RELIGARE ENTERPRISES LIMITED Regd. Office: 2nd Floor, Rajlok Building, 24, Nehru Place, New Delhi – 110 019 CIN: L74899DL1984PLC146935 Phone: +91-11-4627 2400, Fax No. : +91-11-4627 2447

Website: www.religare.com / email: investorservices@religare.com CORRIGENDUM TO NOTICE OF EXTRA-ORDINARY GENERAL MEETING

We draw your kind attention towards our Notice dated February 19, 2018 calling the Extra-Ordinary General Meeting of the Company ("Notice" to be held on Monday, March 19, 2018 at 11.00 A.M. at Air Force Auditorium, Subroto Park, New Delhi - 110010 sent through permitted mode on February 23, 2018 in respect of Special Business for approving the special resolution for issue of warrants on preferential basis

In the Explanatory Statement pertaining to said Notice, in the table provided in point no (v), the pre-preferential issue shareholding of one of the proposed allottees i.e. Ms. Sharda Jain at Sr. No. 7, has been stated as **Nil**, on the basis of an inadvertent mistake in the disclosures received from her. However, it has come to our notice as per the revised disclosure received from her that she held 100,000 equity shares of the Company as on relevant date i.e. February 16, 2018.

Consequently, in light of the above, the explanatory statement pertaining to the said business needs to be modified. Hence, the members are requested to consider the following revised details of Ms. Sharda Jain v. The Identity of the natural persons who are the ultimate beneficial owners of the shares/Warrants proposed to be allotted and/ or who ultimately control the proposed allottees, the percentage of pre and

| post preferential issue capital that may be neid by them: | | | | | | | |
|---|---|-----|--------------------|-----------|---|--|--|
| Identity of Proposed allottees | (Non-Persons Promoter) who are the ultimate beneficial owners | | | | Post-issue shareholding on exercise of Warrants* | | |
| Sharda Jain | Individual | N.A | 100,000 (0.06%) | 1,005,740 | 1,105,740 (0.31%) | | |
| | | | | | | | |

Assuming full conversion of warrants By Order of the Board of Directors Reena Jayara Company Secretary Date: March 09, 2018

Balmer Lawrie & Co. Ltd (A Government of India Enterprise) **Information Technology Department**

Regd. Office: 21, N S Road, Kolkata-700 001 CIN: L15492WB1924GOI004835, Website: www.balmerlawrie.com Phone: 033-22225204, E-mail: thekutte.p@balmerlawrie.com

#GiveItUp

Public Tender

Balmer Lawrie & Co. Ltd. invites offers from reputed vendors towards "Public E-Tender for Supply, Installation, Configuration, Testing and Implementation of Server Infrastructure solution".

Last date for submission of required supporting hard copy documents and completion of e-bidding is 23.03.2018 till 1800 hours IST. Interested parties may download the tender details from Balmer Lawrie's website http://www. balmerlawrie.com and/or https://balmerlawrie.eproc.in and participate in the e-Tender.

It is the bidders' responsibility to keep track of any change by viewing the addendum/corrigendum issued by the tender inviting authority on time-to-time basis in the e-Procurement platform.

Coal India Limited (A Maharatna Company)



3rd floor, Core-2, Premises no-04-MAR, Plot no-AF-III, Action Area-1A, Newtown, Rajarhat, Kolkata-700156 Phone: 033-2324-6526, Fax: 033-23246510 E-Mail: mviswanathan2.cil@coalindia.in Website: www.coalindia.in CIN- L23109WB1973GOI028844

NOTICE FOR BOARD MEETING / RECORD DATE FOR INTERIM DIVIDEND

The Board of Directors of CIL in its meeting on Wednesday, the 7th March'2018 had deferred consideration of Interim Dividend and decided to hold another Board Meeting on Saturday, the 10th March' 2018 to consider payment of Interim Dividend for FY 2017-18, if any.

The Company has fixed Monday, the March 19, 2018 as the 'Revised Record Date' for the purpose of payment of Interim Dividend on Equity Shares for the Financial Year 2017-18, if declared by the Board.

Shareholders whose names appear (a) as Beneficial Owners as on March 19, 2018 (close of business hours) as per the list to be furnished by the Depositories in respect of the shares held in electronic form, and (b) as Members in the Register of Members of the Company as on March 19, 2018 (close of business hours) after giving effect to all valid share transfers in physical form received on or before March 19, 2018, would be entitled to the said Interim Dividend, if declared.

All transfer Deeds, requests for change of Address, Bank particulars/Mandates/ECS Mandates should be lodged with the Company's R&T Agent- M/s. Alankit Assignments Limited, Alankit Height, 1E/13 Jhandewalan Extension, New Delhi-110055 in case of shares held in physical form on or before **March 19, 2018**. The above details in respect of the shares in electronic form should be sent to the respective Depository Participant by the Shareholders. Further, in terms of SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 and "Code of Internal Procedures and Conduct for Prevention of Insider Trading in Securities of Coal India Limited", the "**Trading Window**" shall remain closed until the end of 48 hours after the announcement of decision of Board of Directors regarding payment of Interim dividend, if any, is made public on March 10, 2018.

The said notice may be accessed on the company's website at www.coalindia.in under "Investor Centre, Events & Announcements" and also on the stock exchanges website www.bseindia.com and www.nseindia.com.

For Coal India Limited

Place: Kolkata (M.Viswanathan)

Company Secretary & Compliance Officer 8th March' 2018 Visit us at http://www.coalindia.in

જાહેર સૂચના જાહેર જનતાને આથી જણાવવામાં આવે છે કે અમારા અસીલ, **મેં. મુથૂટ ફાયનાન્સ લિ. (GSTIN 32AABCT0343B1Z7), રજીસ્ટર્ડ <mark>ઓફિસ: 2જો માળ, મુથૂટ ચેમ્બર્સ, બેનર્</mark>ઝ**

ਦੇ।S, કોર્ચી-682018, કેરલા, ભારત, CIN: L65910KL1997PLC011300, ફોન: +91 484-2396478, 2394712, ફેક્સ: +91 484-2396506, mails@muthootgroup.com,

www.muthootfinance.com નીચે આપવામાં આવેલી વિગતો અનુસાર, કરજની ચુકવણીમાં કસૂર કરનાર જ્રણ લેનારાઓ દ્વારા, તેમની તરફેણમાં ગીરો મૂકવામાં આવેલા ઘરેણાઓની (30.06.2017 સુધીના સમયગાળાના એનપીએ ખાતાઓ માટે) હરાજી કરી રહ્યા છે. Silvassa-(Ut): MGL-42, 51, 69, 199, 208, 235, 243, 244, MPL-33, MSL-12576, 12676, 12849, 12904, 12929, 12950, 13070, 13276, 13298, 13369, 13479, 13501, 13517, 13526,

13617, 13618, 13644, 13672, 13684, 13722, 13728, 13732, 13761, 13779, 13795, 13797, 13807, 13811, 13821, 13824, 13826, 13835, 13840, 13917, 13952, 13986, 14004, 14046, 14049, 14079, 14089, 14134, 14142, Silvassa-District Court: MGL-38, 71, 74, 82, 83, 84, 85, 92, 98, MSL-3009, 3048, 3067, 3119, 3142, 3152, 3160, 3162, 3243, 3306, 3327, 3330, 3377, 3443, 3466, 3486, 3497, 3502, 3543, 3547, 3549, 3550, 3551, 3573, 3577, 3581, 3606, 3607, 3612, 3638, 3640, 3641, 3642, 3646, 3647, 3648, 3653, 3654, 3657, 3680, 3686 3693, 3694, 3695, 3697, 3705, 3708, 3709, 3714, 3746, 3750, 3803, 3814, 3815, 3818, 3832, 3836, 3846, 3895, 3922, 3937

નકલી/ઓછી શુદ્ધતાના ઘરેણાઓની હરાજી, (31.10.2017 સુધીના સમયગાળાના ખાતાઓની) **ଧ୍ରେ** ଅବସ୍ଥାନ ବ୍ୟର୍ଥ ଓଡ଼ିଆ ବ୍ୟର ଓଡ଼ିଆ ବ୍ୟର୍ଥ ଓଡ଼ିଆ ବ୍ୟର ଓଡ଼ିଆ ବ୍ୟର ଓଡ଼ିଆ ବ୍ୟର ଓଡ଼ିଆ ବ୍ୟର ଓଡ଼ିଆ ବ୍ୟର୍ଥ ଓଡ଼ିଆ ବ୍ୟର ଓଡ଼ିଆ ବ୍ୟ

Silvassa-District Court: MGL-614, MSL-4441

Place: New Delhi

શાખાના મથાળા હેઠળ દેખાડવામાં આવેલા લોન ખાતાઓ સંબંધી હરાજી જે તે શાખામાં સંચાલિત કરવામાં આવશે.

તેમ છતાં ફુપા કરી એ વાતની નોંધ લો કે જો હરાજી આપવામાં આવેલી તિથિ (ઓ)પર પૂરી ન થાય, તો તેવી રિથતિમાં તે સંબંધી હરાજી 16.03.2018 ચથાક્રમ First Floor, Shop No. 101 & 102, Roshan Avenue-Vapi Main Road,Silvassa-Dadra & Nagar Haveli-396230 ખાતે સંચાલિત કરવામાં/ચાલુ રાખવામાં આવશે અને આગળ તેમ છતાં જો ઉપરોક્ત ઘરેણાઓની આ તિથિઓ પર સફળતાથી હરાજી ન થઈ શકે, તો આવી હરાજીને તે પછી આવતા દિવસોમાં, તે જ સ્થળે, ચાલુ રાખવામાં આવશે. તે સંબંધમાં આગળ કોઈ પણ સચનાઓ આપવામાં નહિં આવે.

471, 474, 475, 476, 478, 488, 492, 496, MSL-48938, 50761, 50901, 51300, 51541, 52490, 52838, 52843, 53026, 53264, 53431, 53830, 53891, 53915, 53984, 53985, 53995, 54023 54039, 54084, 54179, 54402, 54405, 54424, 54482, 54503, 54583, 54599, 54610, 54620, 54654, 54656, 54729, 54742, 54758, 54854, 54855, 54878, 54897, 54976, 54986, 54992 55033, 55035, 55042, 55076, 55212, 55260, 55572, 55922, 55974, 56028, 56046, 56094, 56130, 56221, 56254, 56265, 56269, 56313, 56348, 56388, 56405, 56429, 56497, 56527 56557, 56558, 56568, 56585, 56621, 56622, 56698, 56736, 56783, 56837, 56846, 56894, 56917, 56969, 56977, 56991, 56993, 56995, 56996, 57052, 57116, 57219, 57224, 5723157271, 57284, 57288, 57289, 57305, 57306, 57325, 57327, 57332, 57348, 57365, 57373, 57374, 57381, 57384, 57391, 57409, 57410, 57425, 57433, 57453, 57459, 57485, 57532 57533, 57570, 57583, 57617, 57636, 57666, 57667, 57677, 57712, 57751, 57758, 57780, 57783, 57803, 57818, 57819, 57820, 57821, 57857, 57863, 57878, 57950, 57959, 57962 57985, 57995, 58015, 58033, 58043, 58089, 58096, 58103, 58109, 58118, 58124, 58136, 58138, 58180, 58190, 58198, 58202, 58222, 58222, 58222, 58272, 58287, 58280, 58305, 58310, 58388, 58340, 58362, 58362, 58362, 58372, 58287, 58280, 58362, 58372, 58287, 58280, 58362, 58372, 58287, 58280, 58362, 58372, 58387, 58 58624, 58643, 58644, 58645, 58647, 58655, 58663, 58673, 58682, 58688, 58694, 58710, 58721, 58737, 58739, 58741, 58743, 58752, 58765, 58788, 58802, 58809, 58811, 58875 58912, 58926, 58930, 58933, 58937, 58963, 58968, 59005, 59029, 59058, 59070, **Surat- Adajan**: MAL-970, 1054, 1301, MGL-9, 11, 15, 28, 30, 120, 235, 273, 291, 304, 305, 335, 337, 343, 356, 370, 372, 399, 438, 491, 492, 497, 517, 524, 534, 538, 548, 557, 562, 608, 609, 617, 620, 642, 1105, MHL-178, 232, 233, 234, 240, MLS-19, MOS-41, MPL-142, 214, 221, 230, 243, MSL-28496, 29145, 29268, 29309, 29501, 29593, 29656, 29678, 29700, 29755, 29859, 29917, 29962, 29980, 30015, 30057, 30059, 30087, 30098, 30112, 30126 30133, 30134, 30137, 30157, 30176, 30187, 30189, 30212, 30213, 30214, 30225, 30228, 30242, 30279, 30289, 30290, 30304, 30327, 30332, 30350, 30512, 30739, 30830, 30869, 30883, 30884, 30956, 31025, 31050, 31052, 31092, 31131, 31187, 31224, 31343, 31392, 31414, 31416, 31447, 31459, 31465, 31474, 31485, 31494, 31508, 31512, 31541, 315444, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544, 31544,31545, 31552, 31575, 31614, 31629, 31635, 31636, 31637, 31645, 31646, 31653, 31665, 31680, 31686, 31688, 31691, 31692, 31693, 31694, 31695, 31696, 31697, 31701, 31708 31728, 31735, 31742, 31743, 31760, 31768, 31805, 31808, 31809, 31867, 31869, 31878, 31883, 31885, 31945, 31946, 31984, 31986, 32002, 32010, 32011, 32036, 32043, 32061 32074, 32075, 32076, 32111, 32112, 32118, 32119, 32121, 32124, 32130, 32139, 32140, 32146, 32147, 32153, 32159, 32166, 32176, 32190, 32210, 32211, 32214, 32215, 32226, 32251, 32252, 32253, 32254, 32261, 32273, 32274, 32277, 32279, 32291, 32291, 32292, 32313, 32330, 32331, 32376, 32377, 32407, 32412, 32443, 32444, 32454, 32470, 32477, 32508, 32510, 32577, 32610, 32611, 32652, 32673, 32676, MTL-31186, Surat -Jolly Plaza: FBL-17, MAL-327, MHL-102, MSL-11256, 11301, 11450, 11549, 11608, 11664, 11668, 11690, 11731, 11770, 11836, 11856, 11934, 11961, 12072, 12081, 12113, 12168, 12185, 12267, 12289, 12370, 12371, 12392, 12405, 12406, 12407, 12415, 12416, 12422, 12432, 12451, 12475, 12493, 12502, 12507, 12531, 12536, 12538, 12539, 12547, 12577, 12593, 12627, 12635, 12668, 12671, 12698, 12705, 12710, 12714, 12715, 12757, 12787, Surat - Tower Road: MGL-77, 140, 155, 192, 227, 231, 234, 260, 270, MOS-7, MPL-113, 114, 115, MSL-14150, 15642, 15797, 15800, 16047, 16113, 16145, 16265, 16340, 16348, 16399, 16550, 16633, 16634, 16637, 16805, 16806, 16862, 16918, 16932, 16935, 16954, 16966, 16975, 16976, 16981, 17008, 17012, 17022, 17028, 17034, 17060, 17160, 17187, 17207, 17216, 17227, 17252, 17357, 17387, 17396, 17404, 17445, 17452, 17454, 17456, 17467, 17533, 17534, 17547, 17577, 17597, 17597, 17601, 17604, 17605, 17612, 17614, 17624, 17632, 17637, 17665, 17675, 17677, 17720, 17750, 17765, **Surat - City Light:** MGL-56, 100, 127, MHL-136, 180, MOS-19, MSL-7834, 7842, 7875, 8024, 8288, 8434, 8531, 8600, 8722, 8813, 8973, 9029, 9030, 9049, 9093, 9134, 9135, 9146, 9151, 9174, 9178, 9179, 9180, 9181, 9182, 9231, 9232, 9289, 9290, 9291, 9293, 9315, 9318, 9328, **Surat-**Udhna: MGL-71, 96, 108, 120, 138, 157, 165, 209, 212, 215, 227, 282, 300, MPL-63, 75, 76, MSL-17238, 17405, 17704, 17710, 17743, 17809, 17815, 17830, 17860, 17888, 17889, 17890, 17940, 18012, 18015, 18080, 18096, 18172, 18204, 18208, 18214, 18218, 18245, 18263, 18264, 18265, 18266, 18344, 18348, 18404, 18467, 18474, 18510, 18566, 18609, 18676, 18757, 19013, 19128, 19143, 19150, 19201, 19213, 19231, 19318, 19401, 19415, 19436, 19468, 19492, 19569, 19573, 19591, 19593, 19597, 19617, 19627, 19634, 19676 19712, 19722, 19723, 19730, 19760, 19786, 19794, 19797, 19798, 19823, 19854, 19876, 19882, 19926, 19934, 19940, 19958, 19960, 19972, 19990, 20018, 20019, 20020, 20021, 20038, 20061, 20064, 20075, 20090, 20133, 20135, 20149, 20150, 20154, 20178, 20189, 20189, 20190, 20207, 20211, 20212, 20225, 20238, 20247, 20250, 20256, 20263, 20270, 20211, 20212, 20225, 20238, 20247, 20250, 20256, 20268, 20267, 20270, 20 20271, 20288, 20293, 20302, 20303, 20329, 20330, 20405, 20410, 20413, 20415, 20425, 20426, 20439, 20450, 20470, 20485, 20511, 20514, 20521, 20526, 20597, Surat-Kataargram Main Road: MAL-239, 941, MGL-45, 68, 76, 86, 94, 98, 104, MHL-224, 271, MOS-15, 26, MSL-10221, 10297, 10395, 10612, 10799, 11263, 11316, 11333, 11471, 11511, 11512, 11516, 11559, 11573, 11644, 11672, 11681, 11688, 11698, 11699, 11788, 11939, 11959, 12377, 12386, 12395, 12403, 12430, 12552, 12584, 12602, 12632, 12757, 12779, 1 12806, 12844, 12869, 12903, 12907, 12909, 12953, 12956, 12957, 12989, 13022, 13026, 13035, 13053, 13071, 13079, 13110, 13177, 13213, 13215, 13254, 13268, 13290, 13299, 13308, 13309, 13310, 13311, 13313, 13325, 13334, 13352, 13369, 13371, 13383, 13388, 13420, 13424, 13439, 13483, 13495, 13504, 13582, 13587, 13651, 13667, 13705, MTL-8306, **Surat-Render Road**: MGL-113, 128, MSL-4614, 4751, 4830, 4865, 4866, 4883, 4906, 4924, 4925, 5062, 5065, 5173, 5266, 5342, 5356, 5393, 5414, 5419, 5432, 5459, 5557, 5610, 5681, 5704, **Surat-Ved Road**: MAL-509, MGL-28, 39, 113, 153, 170, 180, 210, 219, 220, 232, 235, 251, 265, 307, 344, 354, 693, MHL-264, 265, 278, MPL-50, MSL-6056, 6156, 6306, 6904, 6954, 6991, 7083, 7162, 7168, 7174, 7236, 7264, 7374, 7375, 7381, 7440, 7443, 7492, 7504, 7541, 7653, 7757, 7870, 7911, 7937, 8024, 8071, 8107, 8128, 8130, 8132, 8152, 8185, 8195, 8208, 8255, 8256, 8329, 8349, 8353, 8434, 8450, 8470, 8482, 8502, 8506, 8541, 8542, 8549, 8550, 8634, 8637, 8644, 8661, 8674, 8683, 8695, 8712, 8719, **Surat**-Amroli: CCL-66, 67, MAL-212, MGL-14, 90, 133, 148, 250, 287, 310, MHL-129, MPL-55, MSL-5288, 5525, 5529, 5922, 5997, 5999, 6073, 6137, 6177, 6195, 6315, 6438, 6540, 6625, 6650, 6651, 6664, 6703, 6719, 6816, 6875, 6921, 6922, 6968, 6972, 6973, 6985, 7003, 7013, 7014, 7058, 7069, 7092, 7101, 7115, 7146, 7165, 7218, 7225, 7226, 7287, 7288, 7305 7327, 7328, 7344, 7350, 7351, 7409, 7423, 7502, 7515, 7560, 7563, 7570, 7574, 7629


શાખાના મથાળા હેઠળ દેખાડવામાં આવેલા લોન ખાતાઓ સંબંધી હરાજી જે તે શાખામાં સંચાલિત કરવામાં આવશે.

તેમ છતાં કૃપા કરી એ વાતની નોંધ લો કે જો હરાજી આપવામાં આવેલી તિથિ (ઓ)પર પૂરી ન થાય, તો તેવી રિથતિમાં તે સંબંધી હરાજી 20.03.2018 ચથાક્રમ Muthoot Finance Ltd., Silicon Shop, 1st Floor, Premises F-70-75, Udhana Main Road, Surat-394210 ખાતે સંચાલિત કરવામાં/ચાલુ રાખવામાં આવશે અને આગળ તેમ છતાં જો ઉપરોક્ત ઘરેણાઓની અ તિથિઓ પર સફળતાથી હરાજી ન થઈ શકે, તો આવી હરાજીને તે પછી આવતા દિવસોમાં, તે જ સ્થળે, ચાલુ રાખવામાં આવશે. તે સંબંધમાં આગળ કોઈ પણ સૂચનાઓ

કોહલી ઍંડ સોબતી, એડવોકેટ્સ, એ 59એ, પહેલો માળ, લાજપત નગર-ાા, નવી દિલ્હી - 110024

ગીંધ: ગ્રાહકો અમારા અસીલની લેણી નીકળતી રકમની ચૂકવણી કરી હરાજીની સૂચિત તિથિ પહેલાં તેમના ગીરો મૂકેલા ઘરેણા છોડાવી શકે છે. ગ્રાહક પણ સંપર્ક કરી શકે છે ecoverynorth@muthootgroup.com મોબાઇલ નંબ૨ 7834886464

facebook.com/TheFinancialExpress FinancialExpress.com **e** twitter.com/FinancialExpress





ચોથો માળ, શીવાલીક-ઇશાન, સી એન વિદ્યાલય પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬ વેચાણ માટે જાહેર નોટીસ

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

સિક્યરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટક્શન ઓફ ફાઇના સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર સંપત્તિઓનો કબજો ''જે કાંઈ છે તે છે અને જ્યાં દ ના આધારે વેચાણ કરવા માટે કબજો લેવામાં આવ્યો છે. જેમાં, નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સરફેસી કાયદા અને આ કાયદાના સેક્શન ૧૩(૧૨) તથા સિક્યુરિં ઈન્ટરેસ્ટ(એન્કોસમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ નં. ૩ સાથે વચાણે લેતા મળેલ સાનાની રૂએ દેલદારો અને જમીનદારો/ગિરવેદારોને કિમાન્ડ નોટિસ કટકારી હતી કે અહીં નીચે દર્શાવેલ બાર્ક લેલા જે કિમાન્ડ નોટિસમાં દર્શાવેલ ૨કમ છે તે આગળના વ્યાજ અને ચાર્જેસ-ખર્ચસહિત આ નોટિસની તારીખથી દિન ૬૦ માં ભરપાઈ કરી જાય. દેલદારો /જામીનદારો/ગિરવેદારો આ ૨ક૧ ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયા હોઈ દેશદારો /જામીનદારોને ખાસ અને જાહેર જનતાને સામાન્યપણે નોટિસ આપવામાં આવે છે કે અહીં નીચે વર્ણવેલ મિલકતનો બેંકના અધિકૃત અધિકારીઍ ફિઝિકલ કબજો લીધો છે. દેણદારો /જામીનદારો/ ગિરવેદારો નીચે મુજબ આ રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયા હોઈ બેંક સરફેસી કાયદા હેઠળ મળેલ સત્તાની રૂએ લેણી 🕇 કમ વસૂલ કરવા મા રાજીએ કે જે હતા છે. જે જોઈકારો જોગાઈ મુજબ વેચાલ કરવા સરકેની કાયદાની જોગાઈએ તે કે તે કરાયા કે કરાય છે. જે કરાય ક મીચે દરાવિલ મિલકાનો સરકેની કોચલાની જોગાઈ મુજબ વેચાલ કરવા સરકેની કાયદાની જોગાઈઓ સાથે સિક્યુનિરી છે.જે સર્જા કરવ કાઈ છે તે છે અને જ્યાં છે ત્યાં છે" ના આધારે અત્રે આપલ તારીખે, સમયે અને સ્થળે નીચે આપલ શરતો અને નિયમોને આધારે વેચાલ કરવા માટે જનતા પાસેથી સીલબંધ ભાવ મંગાવવામાં આવે છે

| એ. ફ | દેણદાર/ગીરોદાર અને શાખાનું નામ | ૧૩(૨) મુજબ બાકી રકમ | મિલકતની વિગત | તળિયાની કિંમત | ઈએમડી રકમ |
|---------|--|------------------------|--|--------------------|-------------------|
| ι. | શ્રી બલવીર ધનજીભાઈ જેસાણી (કરજદાર) શ્રી ધનજીભાઈ જે જેસાણી (સદ-કરજદાર) લોન નં. PHR001301936121 | | ગુજરાત રાજય રજીસ્ટ્રેશન જીકો અને સબ જીકો વડોદરા, ગામ ખતંબા જૂનો રેવેન્યુ સર્વે નં. ૧૯૫ બ્લોક નં. ૧૧૫/એ, ૧૧૫/બી અને ૧૧૫/કે રહેણાંક સ્કીમ "અનંતા શુભ લાભ" નામે જાણીતી સ્કીમ, પ્લોટ નં. સી-૭૧ જમીન ક્ષેત્રફળ ૫૫-૨૮ રહે. મીટર્સ અને જોડાયેલ જમીન ક્ષેત્રફળ ૩૦-૩૯ રહે. મીટર્સ ટોટલ જમીન ક્ષેત્રફળ ૮૫-૬૦ અને એ-૧૬ ક્ષેત્રફાળ દેવારા સોસાયટી નો અંદરનો રોડ, દક્ષિણ: પ્લોટ નં. એ-૧૨૬ અને એ-૧૨૬, પૂર્વ: પ્લોટ નં. સી-૭૨ ૦૦, પશ્ચિમ: પ્લોટ નં. સી-૭૨ | Rs. 12,85,000/- | Rs. 1,28,500/- |

નિરીક્ષણની તારીખઃ ૨૩.૦૩.૨૦૧૮,

ટેન્ડર ખોલવાની તારીખ અને સમયઃ ૨૮-૦૩- ૨૦૧૮, બપોરે ૧.૦૦ કલાકે

સંબંધિત ગિરવે રાખેલ અસ્ક્યામતોની વિગતો અત્રે જણાવેલ છે જે ઉપર દર્શાવ્યા મુજબ અધિકૃત અધિકારી/બેંકની શ્રેષ્ઠતમ જાણકારી મુજબ સૂચિમાં દર્શાવેલ વિગતો દર્શાવેલ છે. આ જાહે નોટિસમાં કંઈ રહી ગયું હોય કે કોઈ પણ ભૂલ, નિવેદન-ચૂક બદલ અધિકૃત અધિકારી /બેંકની કોઈ જવાબદારી રહેશે નહીં. તેમ છતાં, ઇચ્છુક બીડરો /ટેન્ડરરોએ તેમનું બીડ જમા કરાવત પહેલાં ભારણ, હરાજીમાં મકેલ મિલકતની વિગતો અંગે જાતે નિરીક્ષણ કરી અને સ્વતંત્ર રીતે તપાસ કરાવી લેવી અને ખાત્રી કરી લેવી.

વેચાણના શરતો અને નિયમો

- વેચાણ આ જાહેરાતમાં દર્શાવેલ અને ટેન્ડર કોર્મમાં આપેલ નિયમો/શરતોને આધીન થશે. વધુમાં, મિલકતની વિગતો અને ટેન્ડર કોર્મ એક્સિસ બેંક લિ.ના અધિકૃત અધિકારી પાસેથી એક્સિસ બેંક લિ., લોન સેન્ટર, ત્રીજો માળ, વિસેંજા હાઉસ, સી. એચ જવેલર્સ કોનકર્ડ જમીન સામે, અલ્કાપુરી, વડોદરા - ૩૯૦૦૦૭. ખાતેથી મળશે. ઉપર જણાવેલ તારીખે મિલકતનું નિરીક્ષણ થઈ શકશે.
- બંધ કવરમાં ટેન્ડરો(માત્ર છાપેલ ટેન્ડર કોર્મ) ઉપર જણાવેલ રિઝર્વ કિંમતના ૧૦% અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી) તરીકે અને રા. ૨૫૦/-નોન-રિકડેબલ ફી સાથે બેંકના ઉપર જણાવે સરનામે મોકલી દેવા જે નીચે સહી કરનારને **તા. ૨৬-૦૩- ૨૦૧૮ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં** કે તે પહેલા મળી જવા જોઈએ. ચૂકવલું 'એક્સિસ બેંક લિ. પેયેબલ વડોદરા'ના નામે શેડ્યુલ્ડ બેંકના માત્ર ડિમાન્ડ ફાક્ટ્સપેઓર્ડરથી થવું જોઈએ. વિકલ્પે અધિકૃત અધિકારીને ઈએમડી સાથે સીલ્ડ ટેન્ડર હાથોહાથ પણ પહોંચાડી શકાશે. ઉપરના સરનામે, આપેલ તારીખે અને
- દેણદારો, સંબંધિત ટેન્ડરરો, જામીનદારો કે વેચાણની મિલકતના માલિકો, જો ઇચ્છા હોય તો વેચાણ માટેની પ્રસ્તાવિત મિલકતો માટે શક્ય તેટલી શ્રેષ્ઠ માન્ય ઓફર (રો) આપી કે સ્પોન્સ કરી શકે છે. શરત એ કે તે વેચાણની જરૂરિયાત/નિયમો અને શરતો સંતોષે
- દેશદારો, સંબંધિત ટેન્ડરરો, જામીનદારો કે વેચાણની મિલકતના માલિકો કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ ટેન્ડર બોલવાના સમયે ઉપસ્થિત રહી શકે છે. ટેન્ડરરો/ખરીદદારોને જો ઈચ્છા હોય તો તેમની ઓફરો સુધારવા માટે ટેન્ડર ખૂલ્યા પછી તક મળશે. એટલે તેમને સલાહ છે કે જાતે અથવા તેમના અધિકૃત અને સત્તા આપેલ હોય તેવા પ્રતિનિધિઓ હાજર રહે.એક્સિસ બેંક લિ કોઈ પણ કારણ આપ્યા વિના તેનો સૌથી ઊંચા /તે તમામ ઓફર (રો)નો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો હક ધરાવે છે.
- જો બીડર સફળ નહીં હોય તો તેને વ્યાજ વગર ઈએમડી પાછી આપવામાં આવશે.
- બેંકે નક્કી કરેલ રિઝર્વ કિંમતથી ઓછી કિંમતે મિલકત વેચાશે નહીં.
- જો સફળ બીડર હરાજી વેચાણના નિયમો અને શરતો પાળવામાં કસૂર કરશે તો ઈએમડીની રકમ અગાઉ નોટિસ આપ્યા વિના જપ્ત કરી લેવાશે
- વેચાણ તેની તરફેણમાં સ્વીકારાય કે તરત જ સફળ બીડરે 🛭 વેચાણ કિંમતની 🛛 ૨૫% ૨કમ (અગાઉ ભરેલ ઈએમડી બાદ કરીને) ભરી દેવાની રહેશે અને બાકીની ૭૫% ૨કમ 🔥 પછી ૧૫ દિવસની અંદર ભરવાની રહેશે. જો સફળ બીડર આપેલ સમયમાં રકમ ભરપાઇ કરવામાં કસરવાર ઠરશે તો બીડરે જમા કરેલ રકમ જપ્ત થઈ જશે અને મિલકત કરી વેચાણ થશે, સિવાય તેને લેખિતમાં સમય વધારી આપવામાં આવ્યો હોય. આપેલ સમયમાં ચૂકવણામાં કસૂર થશે, તો ડિપોઝીટ જપ્ત થઈ જશે અને મિલકત ફરી વેચાણ થશે અને કસૂરવાર ખરીદદારના મિલકતન તમામ દાવાઓ કે તેના પછીના વેચાણની રકમના કોઈ પણ હિસ્સા અંગેના દાવા જપ્ત થઈ જશે.
- સફળ બીડરે કાયદેસર થતા ચાર્જાસ/ફીઝ સ્ટેમ્પ ડ્યૂટીઝ રજિસ્ટ્રેશન ફીઝ, આકસ્મિક ખર્યા વગેરે ભરવાના રહેશે. સફળ બીડરે તમામ સ્ટેચ્યુટરી ડ્યૂઝ પણ જો હોય તો ભરવાના રહેશે. બેં (સિક્યોર્ડ લેણદાર) વેચાણ માટેની ગિરવે મિલકત બાબતે કોઈ પરવાનગી/પરવાનો વગેરે આપવાની જવાબદારી લેતી નથી.
- ૧૦. બેંકને કોઈ પણ કારણ આપ્યા વિના કોઈ પણ / તમામ બીડ/ ટેન્ડર /ઓફર(રો) નો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો કે મોકૂક રાખવાનો /પાછળ ઠેલવાનો /રદ કરવાનો તેમ જ અગાઉ નોટિસ આપ્યા વિના વેચાણની કોઈ પણ કે તમામ શરતોમાં ફેરફાર કરવાનો અબાધિત હક ધરાવે છે. બેંકનો એ પણ અધિકાર સુરક્ષિત છે કે સરફેસી નિયમો, ૨૦૦૨માં આપેલ કોઈ પણ પ્રકાર ૧૧. દેલાદાગ /જામીનદાર/ગિરવેદારને અત્રે સિક્યુરિટી ઇન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮(ફ) તરફ ધ્યાન દોરતી નોટિસ આપવામાં આવે છે કે જો ડિમાન્ડ નોટિસમાં આપેલ
- રકમ પૂરેપૂરી ભરપાઈ નહીં થઈ હોય તો ઉપર જણાવેલ સિક્યોર્ડ અસ્ક્યામતોનું આ નોટિસના સંદર્ભમાં વેચાણ થશે. ૧૨. વેચાણ બેંકની મંજૂરીને અધીન છે.
- ૧૩. કોઈ પણ સ્પષ્ટતા માહિતી માટે રસ ધરાવતી પાર્ટીઓ સંપર્ક કરે, મિલકત માટે શ્રી અભિષેક અવશ્થી, મો. 98250 97367. દેણદાર અને જામીનદારોને સરકેસી કાયદો. હેઠળ સ્ટેસ્થટરી ૩૦ દિવસીય વેચાણ નોટિસ :

ઉપરના દેણદાર/સહ- દેણદાર/ગિરવેદારોને નોટિસ આપવામાં આવે છે કે તેમણે હરાજીની તારીખ પહેલાં નોટિસમાં દર્શાવેલ ૨કમ વ્યાજ તથા થયેલ અને થનાર ખર્ચા સાથે ભરપાઇ કરી જવી, જેમ કસૂર કર્યેથી નીચેની વિગતો મુજબ ગિરવે મિલકતો. હરાજી/વેચાણ થશે અને જો કાંઈ બાકી રહેતું હશે તો દેણદાર/જામીનદાર પાસેથી વ્યાજ અને ખર્ચ સહિત વસૂલ કરવામાં આવશે.

તારીખઃ ૧૦-૦૩-૨૦૧૮, સ્થળઃ વડોદરા

સહી/- અધિકૃત અધિકારી, એક્સિસ બેંક લિ.

કોર્પોરેશન બેંક 🚨 Corporation Bank ઇ-હરાજી વેચાણ નોટીસ ૧૦૧, પ્રથમ માળ, ગાયત્રી કોમર્શિયલ સેન્ટર, પરિમલ સ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫ ફોન : ૦૨૮૧-૨૫૮

सीड्युरीटार्धञ्रेशन अने रीडन्स्ट्रडशन ओइ इायनान्सीयल એसेटस अने સીક્ચરીટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ અંતર્ગત સ્થાવર તથા જંગમ મિલ્કતોનું વેચાણ

સાંગુરાટા ઇન્ટરસ્ટ અંકટ-૨૦૦૫ અંતાગત સ્વાપર તથા જગન તાલકતાનું વચારા કોર્પોરેશન બેંકના અધિકૃત અધિકારી દ્વારા બેંકના નીચે જણાવેલા દેણદારો પાસેથી સુરક્ષિત બાલી લેણાની રકમ, ત્યાજ તથા અન્ય ખર્ચ સાથેની કુલ રકમની વસુલી પેટે નીચે જણાવેલ સ્થાવર તથા જંગમ મિલ્કતો સીક્યુરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન એફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એફ સાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ કલમ ૧૩(૧) એક્ટ-૨૦૦૨ હેઠળ દેણદારો તથા ગેરેન્ટર પાસેથી જપ્ત કરેલ છે. આ નોટીસ દ્વારા જોદર જનતાને જાણ કરવાની કે નીચે જણાવેલ મિલ્કતોનું ઇ-હરાજી દ્વારા બાકી લેણાની રકમની વસુલી કરવાની છે જેની ઇ-હરાજી તા. ૨૭-૩-૨૦૧૮ ના રોજ મિલ્કતો 'જે છે તે સ્થિતિ અને સ્થળ' પર અન્ય શરતોને આધિન ચોજાશે. મિલ્કતો ટાઇગર મોબાઇલ એપ પરથી પણ જાણી શકાશે. ઇ-હરાજીની તારીખ ૨૭-૩-૨૦૧૮ સમય સવારે ૧૧:૦૦ થી બપોરના ૧૨:૦૦ અને છેલ્લી પ મીનીટ દરમ્યાન

લોન લેનાર : મે. દેમ કોટેક્ષ, ક્લેટ નં. ૪૦૩, ચોથો માળ, શુભ રેસીકેન્સી, આર.કે. પાર્ક-૨, આર.કે.નગર પાસે, કાલાવ**ડ રોક, રાજકોટ-**૩૬૦૦૦૫ અને ⁄ અથવા સર્વે નં. ૨૪ અને ૨૨, એનબી-૮બી, ગામ પ્લોટ નં. ૨, સર્વે નં. ૨૪૫, ૮-એ નેશનલ હાઈ-વે, ગામ જાલીકા, તાલુકો વાંકાનેર, જી. રાજકોટ-૩૬૩૬૨૧. **ગેરેન્ટરો** :

- (૧) શ્રી રણછોડભાઇ પરસોત્તમભાઇ દાવડા
- કલેટ નં. ૨૦૧, શંખેશ્વર એપાર્ટમેન્ટ, બીજો માળ, રોચલ પાર્ક, શેરી નં. ૫, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫ (૨) શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડા
- "'ઉંમીયા નિવાસ'', પટેલ નગર, શેરી નં. ૪, સદ્ભાવના સોસાયટી, સોરઠીયાવાડી, રાજકોટ-૩૬૦૦૦૨ (3) શ્રી વિજયભાઇ ક્રાંતિભાઇ વિરપરીયા
- (*) ના ન કપ્તાર કારાપાઇ ભરપદાયાં (*) બી કેશવલાલ મોહનભાઇ કુળદુ શુભ રેસીકેન્સી, ફ્લેટ નં. ૪૦૩, આર કે પાર્ક, આત્મીય કોલેજ પાછળ, રાજકોટ-૩૬૦૦૦૫ (પ) શ્રી અશ્વિનભાઇ સ્ત્રેશભાઇ કૃળદુ
- **૨૯૧, કોલીથક, તાલુકો ગોર્ડલ, જી. રાજકોટ-૩૬૦૩૧૧** (૬) શ્રીમતી વસંતીબેન વિજયભાઇ વિરપરીયા
- શ્રી વલ્લભ'
- ું, ગરનારા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ-૩૬૦૩૧૧ (૭) શ્રીમતી ભારતીબેન દિનેશભાઇ દાવડા
- ઉમીયા નિવાસ'', પટેલ નગર, શેરી નં. ૪, સદ્ભાવના સોસાયટી, સોરઠીયાવાડી, રાજકોટ-૩૬૦૦૦૨
- **બાકી લેણા :** તા.૦૮-૦૩-૨૦૧૮ સુધીની બાકી રકમ રૂ. ૧૭,૭૯,૦૧,૦૧૧.૭૫ (રૂપિયા સત્તર કરોડ, ઓગણાએંશ લાખ, એક હજાર અગિચાર અને પૈસા પંચોતેર પૂરા)

સુરક્ષિત લેણદારો : કોર્પોરેશન બેંક, એસએમઇ શાખા, રાજકોટ.

ડીમાન્ટ નોટીસ તા. ૦૨-૧૧-૨૦૧૬ (તા. ૦૮-૧૨-૨૦૧૬ ના રોજ અખબારમાં પ્રકાશિત) કબજા તા. ૨૦-૦૨-૨૦૧૭

અરનેષ્ટ નાણા ડીપોઝીટ (ઈએમડી) ા. ફેક્ટરી જમીન અને બિલ્ડીંગ : પ્લોટ નં. ૨, જાલીડા ગ્ર.૨૩.૮૬ લાખ

- ફ્લેટ નં. ૧૮, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા રૂ. ૧.૫૫ લાખ ક્લેટ નં. ૧૯, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા રૂ. ૧.૪૭ લાખ
- ફ્લેટ નં. ૩૦, જુચ ઇન્ડસ્ટ્રીચલ એરીયા, ભુણાવા ગ્રે. ૨.૧૨ લાખ પ. પેલોટ નં. ર, શ્રીજી ઇન્ડસ્ટ્રીચલ એરીચાં, ભુણાવા. ગ્રૂ. ર. ૬૮ લાખ ક. પ્લોટ નં. ૧૦, દેવ ઇન્ડસ્ટ્રીચલ એરીચા ભુણાવા ગ્રૂ. ૧.૭૩ લાખ
-). પ્લોટ નં. ૨૨, શ્રીજી ઇન્ડસ્ટ્ટીયલ એરીયાં, ભૂણાવા. રૂ ૨.૪૫ લાખ એકાઉન્ટ નંબર : 510101003756040, આઈએફએસસી કોક - CORP0000488, આરટીજીએસ દ્વારા
- अनाभव रहम : ા. ફેક્ટરી જમીન અને બિલ્ડીંગ : પ્લોટ નં. ૨, જાલીડા ગ્રૂ.૨૩૮.૫૮ લાખ
- ફ્લેટ નં. ૧૮, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા ગ્ર. ૧૫.૫૦ લાખ ક્લેટ નં. ૧૯, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા ગ્ર. ૧૪.૭૦ લાખ
- કલેટ નં. ૩૦, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા ગ્રે. ૨૧.૧૧ લાખ
- પ. પ્લોટ ન . ર, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા. રૂ. ૨૬.૮૦ લાખ ક. પ્લોટ ન . ૧૦, દેવ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભુણાવા રૂ. ૧૭.૨૮ લાખ

ર. પ્લોટ નં. ૨૨, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એરીયાં, ભુણાવા. ગ્ર ૨૪.૪૮ લાખ મિલ્કતનું વર્ણન

- ા. ઇએમજ/પ્રથમ ખર્ચ, ફેક્ટરી જમીન : પ્લોટ નં. ૨, આર.એસ. નં. ૨૪૫ પૈકી, ૮-એ નેશનલ હાઇ-વે, જાલીડા, તાલુકો વાંકાનેર, જી રાજકોટ ૧૨૭૦૦ સ્કે. ચાર્ડ અને શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડાની માલિકીનો છે.
- ર. ઇએમજી /પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૧૮, આરએસ નં. ૭૩ પૈકી, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી રાજકોટ ૪૮૪.૨૨ સ્કે. ચાર્ડ અને શ્રીમતી વસંતીબેન વિજયભાઇ વિરપરીયાની માલિકોનો છે.
- ૩. ઈએમજ ∕ પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૧૯, આરએસ નં. ૭૩ પૈકી, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ ૪૫૯.૨૬ સ્કે. ચાર્ક અને શ્રીમતી વસંતીબેન વિજયભાઇ વિરપરીયાની માલિકીનો છે.
- ′. ઇએમજી /પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૩૦, આરએસ નં. ૭૩ પૈકી, જય ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ કપલ.૬૭ સ્કે. ચાર્ડ ેઅને શ્રીમતી ભારતીબેન દિનેશભાઇ દાવડાની માલિકીનો છે. ા. ઇએમજ /પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૨, સર્વે નં. ૪૯ પૈકી ૧, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી
- રાજકોટ ૭૯૯.૫૯ સ્કે. ચાર્ડ અને શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડાની માલિકીનો છે. . ઇએમજી /પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નું. ૧૦, સર્વે નં. ૭૨ પૈકી ૧/પૈકી ૧, દેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ જી. રાજકોટ ૫૩૯.૭૧ રકે. ચોર્ડ અને શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડાની માલિકીનો છે.
- 9. ઇએમજી /પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૨૨, સર્વે નં. ૪૯ પૈકી ૧, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી રાજકોટ ૭૩૦.૫૩ સ્કે. યાર્ક અને શ્રી રણછોડભાઇ પરસોત્તમભાઇ દાવડાની માલિકીનો છે.

ઈ-હરાજીની શરતો અને સ્થિતિ : ઇ-હરાજી જે તે સ્થિતિ અને સ્થળ પર યોજાશે.

- . ઇ-હરરાજી બેંકની વેબ સાઇટ https://corpbank.auctiontiger.net પર તા. ૨૭-૦૩-૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરના ૧૨:૩૮ વાગ્યા સુધી ચોજાશે, જરૂર પડ્યે ૧૦ મીનીટ સુધી વધુ લંબાવાશે. હરાજી અને દાવેદાર ઓનલાઇ ઇ-બાઇડીંગ બેંકની વેબસાઇટ https://corpbank.auctiontiger.net ક્ષારા જ કરી શકશે. દાવેદારો તેના માં
- બેંકની વેબસાઇટ પૂરી રીતે ચકાસી શરતો અને અન્ય વિગતો જાણી પછી જ ઇ-હરરાજીમાં દાવેદારી નોંધાવશે
- . ઇચ્છુક દાવેદારે તેનુ નામ પોર્ટલ https://corpbank.auctiontiger.net અને તેઓનું યુઝર આઇડી તથા પાસવર્ડ વિના મુલ્ચે મેળવી શકશે, તેમજ સંભવિત દાવેદાર ઇ-હરારજીની ઓનલાઇન ટ્રેઇનીંગ મે. ઇ-પ્રોક્ચોરમેન્ટ ટેક્નોલોજીસ લી. (ઓક્શન ટાઇગર),અમદાવાદ શ્રી જીનેશ જીરાવાલા મો.9537046315 gujarat@auctiontiger.net, શ્રી રીક્રીન બ્રહ્મક્ષત્રિય મો.9978591888 rikin@auctiontiger.net ล่นร์ ต่. 079-40230802/821/813/814/815/816/817/818/822. ริร์เคิรต ย์भิต आย์ร์โ support@auctiontiger.net. નોટીસમાં ઉપરોક્ત અનામત ભાવના ૧૦% ઇએમડી રકમ કિમાન્ક ડ્રાફ્ટ/આરટીજીએસ માર્ગ દ્વા ૨૬-૦૩-૨૦૧૮ ના રોજ પઃ૦૦ વાગ્ચે અથવા પહેલા રાજકોટ -એસએમઇ શાખાના તરફેણમાં કિમાન્ક ડ્રાફ્ટ/આરટીજીએસ દ્વારા જમા કરાવવાની છે.
- રેકુંગ અધિકૃત અધિકારીની તમામ જાણકારી દ્વારા આ દરરાજાની ભાકતો પર કોઈ પણ જાતનું અન્ય લેણું નથી કે કોઇનો દરક દિસ્સ હોંકા અધિકૃત અધિકારીની તમામ જાણકારી દ્વારા આ દરરાજાની ભિક્તો પર કોઈ પણ જાતનું અન્ય લેણું નથી કે કોઇનો કદક દિસ્સો નથી છતા ઇચ્છુક દાવેદાર જાતે દરેક અસ્કચામતોની પૂરી તપાસ કરી, ભિક્તોની માલિકી, તેમજ અન્ય વિગતોની જાણકારી મેળવી પછી જ ઇ- દરાજીમાં દાવેદાકી નોંધાવવી. બેંક દ્વારા આ જાહેર ખરબ નોટીસથી કોઇપણ જાતનું વેચાણું મોમાણ કે સોંપણીની જવાબદારીની ખાતરી આપવામાં આવતી નથી. સુરક્ષિત લેણદાર બેંક અથવા અધિકૃત અધિકારીની કોઇપણ જાતનું થઈ પાર્ટી દાવો, હક્ક કે લેણાની જવાબદારી રહેશે નહીં. જે વ્યક્તિ આ ઇ- દરાજીમાં દાવેદાર સાબિત થાશે તેમણે વેચાણની રહેશે. જો દાવેદાર સ્પર્જ (ઇએમડી રકમ બાદ કરી) તરત જ જમા કરવામાં બેહ્યું જ પાર્ટી કરાયા માને કરાયા કે આવ્યો અને અમે જ જમી કરોતી નોંધા તેનો દાવો જતો કરાયામાં આવ્યો અને તેમાં જેથી કરોતી દાવો દાવેદાર પાયા મહિ આવે
- કરવામાં આવશે. અને તેમણે જમી કરોવેલી ઈએમડી રકમ પણ પરત કરવામા નિર્દે આવે.
- બેંક દ્વારા ઇ-હરાજી મુલતવી રાખવુ કે રદ કરવું તેમજ ઇ-હરાજીમાં કોઇપણ શરતોમાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે વધુ વિગત માટે સંપર્ક શ્રી સચીન વર્મા, ચીફ મેનેજર સંપર્ક નં. 0281-2589790 મો. નં. 7043337028 Email cb488@corpbank.co.in. સંપૂર્ણ શાખાનું સરનામુ : કોર્પોરેશન બેંક, એસએમઇ શાખા, ૧૦૧, પ્રથમ માળ, ગાયત્રી કોમર્શિયલ સેન્ટર, પરિમલ સ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫ અથવા ઇ-હરરારજી મે. ઇ-પ્રોક્ચોરમેન્ટ ટેકનોલોજીસ લી. (ઓક્શન ટાઇગર), અમદાવાદ. શ્રી જીનેશ જરાવાલા મો.9537046315 gujarat@auctiontiger.net, શ્રી રોકીન બ્રહ્મક્ષત્રિય મો.9978591888 rikin@auctiontiger.net સંપર્ક નં. 079-40230802/821/813/814/815/816/817/818/822. ટેકનિકલ ઇમેલ આઇડી :
- support@auctiontiger.net. આ જાહેર ખબર નોટીસ દ્વારા બાકી દેણદારો/ગેરેન્ટરો/મોર્ટગેજરોને ૧૫ દિવસની બાકી દેણા જમા કરાવવાની નિયમ ૮ અને ૯ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ નિયમ

ા આ ત્રાર અન્ય આતાર સાત ભાગ હોદાના ત્રાંગ નિયાના અને કર્યા હવાના પાયાના અને હિં ૨૦૦૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. ૧૦. મિલ્કતોનું વેચાણ એએ નં. ૮૯/૨૦૧૭ જે ડીઆરટી-॥, અમદાવાદ ઓફિસને આધિન છે.

સ્થળ : રાજકોટ ારીખ : ૦૯/૦૩/૨૦૧૮ અધિકૃત અધિકારી કોર્પોરેશન બેંક





કોર્પોરેટ ઓફિસઃ સન હાઉસ, પ્લોટ નં. ૨૦૧ બી/૧, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ગુરગાંવ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૩ ફોન : +૯૧ ૨૨ ૪૩૨૪ ૪૩૨૪ CIN: L24230GJ1993PLC019050 વેબસાઇટ : www.sunpharma.com

નોટિસ

ઇન્વેસ્ટ્રર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) સસ્પેન્સ એકાઉન્ટમાં ઇક્વીટી શરો અને દાવા રહીત ડિવિડન્ડોની ફેરબદલી

આ નોટિસ ૭ સપ્ટેમ્બર, ૨૦૧ ૬થી લાગુ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા સુચવાયેલ ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ્ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રીફેડ) નિયમો, ૨૦૧૬ અને ત્યારબાદ સમયેસમયે કરાર્યેલ સુધારાઓ અનુસાર જોગવાઇઓ અન્વયે પ્રકાશીત કરવામાં આવી છે.

નિયમોની અન્ય બાબતોમાં, સતત સાત વર્ષો કે તેનાથી વધુ વર્ષોથી શેરહોલ્ડરો દ્વારા ચુકવણી ન કરાયેલ અથવા દાવો ન કરાયેલ ડિવિડન્ડોની બાબતમાં તુમામ શેરોની ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ સસ્પેન્સ એકાઉન્ટ (આઇઇપએફ સસ્પેન્સ એકાઉન્ટ)માં કેરબદલીની જોગવાઇઓ છે

નિયમોમાં જણાવેલ વિવિધ આવશ્યકતાઓનું પાલન કરીને, કંપનીએ વ્યક્તિગત રીતે લાગતા વળગતા શેરહોલ્ડરો જેમનાં શેર આઇઇપીએફ ઓથોરીટીનાં સસ્પેન્સ એકાઉન્ટર્મા ફેરબદલીને પાત્ર છે તેમને જણાવેલ નિયમો હેઠળ યોગ્ય પગલા(ઓ) લેવા જાણ કરી

જુની રેનબેક્સી લેબોરેટરીઝલિમિટેડ(રેનબેક્સી)સન ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝલિમિટેડ(કંપની)સાથે જોડાઇ છે જે માનનીય હાઇકોર્ટ ઓફ પુંજાબ અને હરિયાણા અને માનનિય હાઇકોર્ટ ઓફ ગુજરાતે મંજુર કરેલ સ્ક્રીમ ઓફ મર્જર(યોજના) હેઠળ ૨૪. માર્ચ, ૨૦૧ પથી લાગુ છે. યોજના અન્વર્ય જુની રેનબેક્સીનાં શેરહોલ્ડરો યોજનામાં જણાવેલ દરનું પાલન કરીને કંપનીનાં શૈરો જારી કર્યા હતાં. ઉપરો ક્ત શેરોમાંથી, જે શેરો ડિવિડન્ડોનાં શેરો સતત છેજ્ઞા સાત કે વધુ વર્ષોથી ચુકવાયા નથી કે દાવો કરાયો નથી તે હવે આઇઇપીએફ

સસ્યેન્સ એકાન્ટમાં તબદીલીને પાત્ર બન્યા છે. કંપનીએ તેની વેબસાઇટ http://www.sunpharma.com/investors/shareholders-information/details-of-shares-to- iepf પર આઇઇપીએફ સસ્યેન્સ એકાન્ટમાં તબદીલીને પાત્ર આવા શેરોની સંપુર્ણ વિ્ગતો અપલોડ કરી છે અને શેરહોલ્ડરોને આઇઇપીએફ સસ્યેન્સ એકાઉન્ટમાં તબદીલીને પાત્ર શેરોની વિગતો ચકાસવા માટે

લાગતાવળગતા શેરહોલ્ડરો જે ફીઝીકલ સ્વરૂપે શેરો ધરાવે છે અને જેમનાં શેર આઇઇપીએફ સસ્પેન્સ એકાઉન્ટમાં તબદીલીને પાત્ર છે, તેમણે નોંધ લેવી કે નિયમોની આવશ્યકતાં અનુસાર કંપની તેમનાં નામે રજીસ્ટર્ડ ઓરીજનલ શેર સર્ટીફીકેટોની બદલીમાં ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટો જારી કરશે અને આ ઓરીજનલ શેર સર્ટીફીકેટો આપમેણએ રદ્ થશે અને બિનુવટાઉ ગુણાશે. શેર હોલ્ડરોને એ એ પણ નોંધ લેવી કે કંપની દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરાયેલ વિગતો નિયમો અન્વયે ડુપ્લીકેટ સર્ટીફીકેટ જારી કરવાની નોટીસ તરીકે ગણવામાં આવશે.

લાગતાવળગતા શેરહોલ્ડરો તરફથી ૮ મે, ૨૦૧૮ સુધી કોઇ વ્યવહાર ન મળે તો તેવા કિસ્સામાં, નિયમોમાં જણાવેલ આવશ્યકતાઓનું પાલન કરવા માટે શેરો અને દાવો ન કરાયેલ ડિવિડૅન્ડો (જુની રેનબેક્સી દ્વારા ૧૬ મે, ૨૦૧૧નાં રોજ જોરી કરાયેલ) નિયમોર્મો જણાવેલ પ્રક્રિયા અનુસાર જણાવેલ તારીખે આઇઇપીએફ એકાઉન્ટમાં તબદીલ કરશે. શેરહોલ્ડરોએ નોંધ લેવી કે આઇઇપીએફ ઓથોરીટી/આઇઇપીએફ સસ્પેન્સ એકાઉન્ટમાં દાવા રહીત ડિવિડન્ડો અને શેરો બંને આવા

શેરો પર પ્રાપ્ત લાભો સહીત તબદીલ કરવામાં આવશે, જો કોઇ આઇઇપીએફ ઓથોરીટી/આઇઇપીએફ સસ્પેન્સ એકાઉન્ટમાંથી તે પરત લેવા દાવો કરવા માંગે છે તો નિયમો હેઠળ જણાવેલ પ્રક્રિયાને અનુસરીને મેળવી શકે છે.

શેરહોલ્ડરોને વિષય સબંધિત કોઇ પ્રશ્ન છે તો તેઓ કેંપનીનાં રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ- લિંક ટાઇમ ઇન્ડિયી પ્રા. લિ., સી-૧૦૧, ૨૪૭ પાર્ક, એલ.બી.એસ માર્ગ, વિખ્રોલી વેસ્ટ, મુંબઈ- ૪૦૦૦૮૩, ટેલી.નં. (૦૨૨) ૪૯૧૮૬૨૭૦, ઇમેઇલઃ rnt.helpdesk@linkintime.co.in નો સંપર્ક કરી શકે છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં આદેશથી સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી

સ્થળ : **મુંબઇ** તારીખ : **માર્ચ ૬, ૨૦૧૮**

સહી/– અશોક આઇ. ભુટા કમ્પ્લેઇન્સ ઓફિસર

કોર્પોરેશન બેંક 🙇 Corporation Bank

કોર્પોરેશન બેંક એસએમઇ શાખા ૧૦૧, પ્રથમ માળ, ગાયત્રી કોમર્શિયુલ સેન્ટર, પરિમલ સ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫ કોન : ૦૨૮૧-૨૫૮૯૭૯૦/૨૫૮૬૪૯૯

ઇ-હરાજી વેચાણ નોટીસ

સીક્યુરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સીયલ એસેટસ અને સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ–૨૦૦૨ અંતર્ગત સ્થાવર તથા જંગમ મિલ્કતોનું વેચાણ

કોર્પોરેશન બેંકના અધિકૃત અધિકારી દ્વારા બેંકના નીચે જણાવેલા દેણદારો પાસેથી સુરક્ષિત બાકી લેણાની રકમ, વ્યાજ તથા અન્ય ખર્ચ કાર્યું છે. કાર્યું છે. એક સાથેની કુલ રકમની વસુલી પૈટે નિર્માણની કુલ રકમની વસુલી પાંડ પહોંચા મહત્વ એક ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ કલમ ૧૩(૨) એક્ટ-૨૦૦૨ હૈઠળ દેણદારો તથા ગેરેન્ટર પાસેથી જપ્ત કરેલ છે. આ નોટીસ દ્વારા જાહેર જનતાને જાણ કરવાની કે નીચે જણાવેલ મિલ્કતોનું ઇ-હરાજી દ્વારા બાકી લેણાની રકમની વસુલી કરવાની છે જેની ઇ-હરાજી તા. ૨૭-૩-૨૦૧૮ ના રોજ મિલ્કતો 'જે છે તે સ્થિતિ અને સ્થળ' પર્ અન્ય શરતોને આફિન યોજાશે. મિલ્કતો ટાઇગર મોબાઇલ એપ પુરર્થી પણ જાણી શકાશે. ઇ-હરાજીની તારીખ ૨૭-૩-૨૦૧૮ સમય સવારે ૧૧ઃ૦૦ થી બપોરના ૧૨ઃ૦૦ અને છેલ્લી ૫ મીનીટ દરમ્યાન કોઈ બીડ મળતા સમય સુધી.

લોન લેનાર : મે. કૈલાશ જીનીંગ અને પ્રેસીંગ પ્રા. લી. સર્વે નં. ૫૩, પ્લોટ નં. ૧૭, ૫/ ૬ પૈકી, ગામ : હકમતાળા, તાલુકા કોટડા સાંગાણી, જી. રાજકોટ-૩૬૦૦૩૦ **ગેરેન્ટરો**:

- (૧) શ્રી રણછોડભાઇ પરસોત્તમભાઇ દાવડા
- નં. ૨૦૧, શંખેશ્વર એપાર્ટમેન્ટ, બીજો માળ, રોચલ પાર્ક, શેરી નં. પ, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦ પ (૨) શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડા
- (૪) ત્રા દિનશભાઇ પરસાતા ભાઇ દાવડા "ઉંકીચા નિવાસ", પટેલ નગર, શેરી નં. ૪, સદ્ભાવના સોસાયટી, સોરઠીચાવાડી, રાજકોટ-૩૬૦૦૦૨ (૩) શ્રી **વિજયભાઇ કાંતિભાઇ વિરપરીચા** "શ્રી વલ્લભ", ગરનારા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ-૩૬૦૩૧૧ (૪) શ્રી **કેશવલાલ મોદનભાઇ ફળદુ** શુભ રેસીડેન્સી, ફ્લેટ નં. ૪૦૩, આર કે પાર્ક, આત્મીચ કોલેજ પાછળ, રાજકોટ-૩૬૦૦૦૫
- (૫) શ્રી વિપુલભાઇ રમેશભાઇ દાવડા . પટેલ નગર. ભોજા ભગત ચોક. રાજકોટ-૩૬૦૩૧૧
- (૬) શ્રી **નરશીભાઇ મોઠનભાઇ કળદુ** કલેટ નં. ૪, આત્મીય એપાર્ટમેન્ટ, શાસ્ત્રી ગ્રાઉન્ડ પાસે, ગાંધી સ્કૂલ સામે, નાનામોવા, રાજકોટ-૩૬૦૦૦૫ (**૭) શ્રી રમેશભાઇ પરસોત્તમભાઇ દાવડા**
- ૯૯, ચંદ્રભાના સોસાયટી, સોરઠીયાવાડી, રાજકોટ-૩૬૦૦૦૨ **બાકી લેણા :** તા.૨૩-૦૨-૨૦૧૮ સુધીની બાકી રકમ ગ્ન. ૧*૭*,૪૮,૮૧,૬૬૧.૪૫ (રૂપિયા સત્તર કરોડ, અડતાલીસ લાખ, એકાશી હજાર,

છસોએકસઠ અને પૈસાં પીસતાલીસ પૂરા) સુરક્ષિત લેણદારો : કોર્પોરેશન બેંક, એસએમઈ શાખા, રાજકોટ.

ડીમાન્ટ નોટીસ તા. ૦૨-૧૧-૨૦૧૬ (તા. ૦૮-૧૨-૨૦૧૬ ના રોજ અખબારમાં પ્રકાશિત) કબજા તા. ૨૦-૦૨-૨૦૧૭

અરનેષ્ટ નાણા ડીપોઝીટ (ઈએમડી) ફેક્ટરી જમીન અને બિલ્ડીંગ: પ્લોટ નં. ૫,૬,૧૭,૧૮ અને ૧૯ સર્વે નં. ૫૩/પી, હડમતાળા, જી. રાજકોટ રૂા.૨૪.૯૩ લાખ

- ક્લેટ નં. ૪૦૩, શુભ રેસીકેન્સી, રાજકોટ ગ્રા.૩.૨૪ લાખ 3. ફ્લેટ નં. ૨૦૪, આત્મીય એપાર્ટમેન્ટ ગ્રૂ. 3.3૧ લાખ રહેણાંક ઘર નં. ૪, ઉમીયા નિવાસ, સદ્ભાવના સોસાયટી ગ્ર. ૪.૬૧ લાખ
- પ. પ્લોટ નં. ૧૯, દેવ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા. રૂ. ૧.૬૦ લાખ ક. પ્લોટ નં. ૧, દેવ ઇન્ડસ્ટ્રીચલ એરીયા ભૂણાવા રૂ. ૩.૦૭ લાખ
- ૭. પ્લોટ નં. ૨૦, દેવ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભુણાવા રૂ ૧.૬૦ લાખ
- ૮. પ્લોટ નં. ૧૪, સિઘ્ધેશ્વર ઇન્ડસ્ટ્રીચલ એરીચા ભુણાવા ગ્ર. ૧.૮૭ લાખ ૯. પ્લોટ નં. ૧, શ્રીજી ઇન્ડસ્ટ્રીચલ એરીચા ભુણાવા ગ્ર. ૧.૫૫ લાખ
- એકાઉન્ટ નંબર : 510101003756040, આઈએફએસસી કોડ CORP0000488, આરટીજીએસ દ્વારા
- ૧. ફેક્ટરી જમીન અને બિલ્કીંગ : પ્લોટ નં. ૫,૬,૧૭,૧૮ અને ૧૯ સર્વે નં. ૫૩/પી, હડમતાળા, જી. રાજકોટ ગ્ર.૨૪૯.૨૪ લાખ
- ફ્લેટ નં. ૪૦૩, શુભ રેસીડેન્સી, રાજકોટ ગ્રં. ૩૨.૪૦ લાખ
- ક્લેટ નં. ૨૦૪, આત્મીય એપાર્ટમેન્ટ ગ્ર. ૩૩.૦૯ લાખ ૪. રહેણાંક ઘર નં. ૪. ઉમીયા નિવાસ, સદભાવના સોસાયટી ગ્ર. ૪૬.૦૨ લાખ
- પ્લોટ નં. ૧૯, દેવ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ભુણાવા. રૂા. ૧૫.૯૨ લાખ પ્લોટ નં. ૧, દેવ ઇન્ડસ્ટ્રીચલ એરીચા ભુણાવા રૂા. ૩૦.૬૧ લાખ
- . ૭. પ્લોટ નં. ૨૦. દેવ ઇન્ડસ્ટીચલ એરીચા ભણાવા ગ્ર ૧૫.૯૨ લાખ
- ૮. પ્લોટ નં. ૪૪, સિધ્ધેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરીયા ભુણાવા રૂા. ૨૮.૬૮ લાખ
- ૯. પ્લોટ નં. ૧, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભુણાવાં રૂ. ૪૫.૪૩ લાખ મિલ્કતનું વર્ણન
- ૧. ઇએમજી/પ્રથમ ખર્ચ, ફેક્ટરી જમીન અને બિલ્ડીંગ પર આવેલ પ્લોટ નં. ૫,૬,૧૭,૧૮ અને ૧૯, સર્વે નં. ૫૩/પી, નેશનલ હાઇવે નં ૮-બી હૈંડમતાળા, તાલુંકો કોટડા સાંગાણી, જિલો રાજકોટ ૫૬૦૨.૮૩ સ્કે. ચાર્ડ અને કંપની દ્વારા માલિકી.
- . ઇએમજી / પ્રથમ ખર્ચ, રેસીકેન્શીયલ ફ્લેટ બેરીંગ નં. ૪૦૩, શુભ રેસીકેન્સી, આર.કે. પાર્ક, આત્મીય કોલેજ પાછલ, રાણી ટાવર નજીક કાલાવડ રોડ, રાજકોટ ૬૨.૭૧ ચો.મી. અને શ્રી કેશવલાલ મોહનલાલ ફળદુની માલિકીનુ છે. . ઇએમજ્/પ્રથમ ખર્ચ, રેસીકેન્શીયલ ક્લેટ બેરીંગ નં. ૨૦૪, બીજો માળ, આત્મીય એપાર્ટમેન્ટ, શાસ્ત્રી ગ્રાઉન્ડ પાસે, ગાંધી સ્કૂલ, ગામ નાનાઓવા (આર.એસ. નં. ૪/પી ટીપીએસ નં. ૨૦, ઓપી નં. ૩, એકપી નં. ૩/૧, પી. નં. ૪+૫+૬+૭+૮+૯, રાજકોટ બીલ્ટઅપ એરીયા ૫૮.૦૦ યો.મી. અને શ્રી નરશીભાઇ મોહનભાઇ ફળદુની માલિકીની છે.
- . ઇએમજી/પ્રથમ ખર્ચ, રેસીકેન્સીયલ હાઉસ બેરીંગ નં. ૪, ઉમીયા નિવાસ, સદ્દભાવના સોસાયટી, સીટી સર્વે નં. ૧૫૩/પી, સોરઠીયાવાડી સર્કલ, રાજકોટ નજીક અને શ્રી રણછોડભાઇ પરસોત્તમભાઇ દાવડા, શ્રી રમેશભાઇ પરસોત્તમભાઇ દાવડા અને શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડા **(ભૌતિક પઝેશન બેંકમાં ઉપલબ્ધ છે.)**
- ાદિનશાભાઇ પરસાદાનાભાઇ દાપુરા પુનાપાંટ વેઝરાખ એકના અંકારા અને કર્યા છે. ા ઇએમજ/પ્રથમ ખર્ચ, ઓઘોગિક પ્લોટ ને. ૧૯, આર.સી.એ. ને. ૭૨, પૈકી દેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જલ્લો રાજકોટ પર ૪૧૬ ચો.મી. એમટીઆરએસ અને શ્રી વિજયભાઇ કાન્તીભાઇ વિરપરીયાની માલિકીની છે. $oldsymbol{i}$. ઇએમજી/પ્રથમ ખર્ચ, ઓદ્યોગિક પ્લોટ નં. ૧, સર્વે નં. ૭૨ પૈકી, દેવ ઇન્ડસ્ટ્રીચલ પાર્ક, ભુણાવા, તાલુકો ગોંડલ, જીલ્લો રાજકોટ માં
- ૭૯૯.૭૨ ચો.મી. અને શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડા ૭. ઇએમજ/પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીચલ પ્લોટ નં. ૨૦, સર્વે નં. ૭૨ પૈકી, દેવ ઇન્ડસ્ટ્રીચલ પાર્ક, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ
- ૪૨૬ ચો.મી. અને શ્રી વિજયભાઇ કાંતીભાઇ વિરપરીયાની માલિકીનો છે. :. ઇએમજી/પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીચલ પ્લોટ નં. ૪૪, સર્વે નં. ૭૩ પૈકી, સિધ્ધેશ્વર ઇન્ડસ્ટ્રીચલ એરીચા, ભુણાવા, તાલુકો ગોંડલ, જી.
- રાજકોટ. ૭૪૯.૪૦ ચો.મી. અને શ્રી દિનેશભાઇ પરસોત્તમભાઇ દાવડાની માલિકીનો છે. દ. ઇએમજ∕પ્રથમ ખર્ચ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૧, સર્વે નં. ૪૯ પૈકી, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ ૧૧૩૩.૯૨ ચો. મી. અને શ્રી વિપુલભાઇ રમેશભાઇ દાવડાની માલિકીનો છે.
- ૧. ઇ-હરાજી જે તે સ્થિતિ અને સ્થળ પર ચોજાશે.
- ત. ઇ-દરાજી બેંકની વેબ સાઇદ https://corpbank.auctiontiger.net પર તા. ૨૭-૦૩-૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી ચોજારો, જરૂર પડચે ૧૦ મીનીટ સુધી વધુ લંબાવારો.
- . દરાજી એને દાવેદાર ઓનલાઇ ઇ-બીડીંગ બેંકની વેબસાઇટ https://corpbank.auctiontiger.net દ્વારા જ કરી શકશે. દાવેદારો તેના મા બેંકની વેબસાઇટ પૂરી રીતે ચકાસી શરતો અને અન્ય વિગતો જાણી પછી જ ઇ-હરરાજીમાં દાવેદારી નોંધાવશો.
- . ઇચ્છુક દાવેદારે તેનુ નામ પોર્ટલ https://corpbank.auctiontiger.net અને તેઓનું ચુઝર આઇડી તથા પાસવર્ડ વિના મુલ્ચે મેળવી શકશે, તેમજ સંભવિત દાવેદાર ઇ-હરરારજીની ઓનલાઇન ટ્રેઇનીંગ મે. ઇ-પ્રોક્ચોરમેન્ટ ટેક્નોલોજીસ લી. (ઓક્શન ટાઇગર),અમદાવાદ શ્રી જીનેશ જીરાવાલા મો.9537046315 gujarat@auctiontiger.net, શ્રી રીક્રીન બ્રહ્મક્ષત્રિય મો.9978591888 rikin@auctiontiger.net ล่นร์ ต่. 079-40230802/821/813/814/815/816/817/818/822. ริร์เคิรต ย์भิต आย์ร์โ
- TIKIT(@auctiontiger.net સપર્ક ન. 0/9-40/230802/821/813/814/815/816/817/818/822. દંકાનેકલ ઇમેલ આઇડી : support(@auctiontiger.net. નોટીસમાં ઉપરોક્ત અનામત ભાવના ૧૦% ઇએમડી રક્ષ્મ કિમાન્ડ ડ્રાંક્ટ/આરટીજીએસ માર્ગ બ્રારા ૧૬-૦૩-૨૦૧૮ ના રોજ પઃ૦૦ વાગ્યે અથવા પહેલા રાજકોટ -એસએમઇ શાખાના તરફેણમાં કિમાન્ડ ડ્રાંક્ટ/આરટીજીએસ બ્રારા જમા કરાવવાની છે. . બેંકના અધિકૃત અધિકારીની તમામ જાણકારી બ્રારા આ દરરાજીની મિલ્કતો પર કોઇ પણ જાતનું અન્ય લેણું નથી કે કોઇની દસ્ક દિસ્સો નથી છતા ઇચ્છુક દાવેદાર જાતે દરેક અસ્કચામતોની પૂરી તપાસ કરી, મિલ્કતોની મોલિકી, તેમજ અન્ય વિગતોની જાણકારી મેળવી પછી જ ઇ-દરાજમાં દાવેદાકી નોંધાવવી. બેંક બ્રારા આ જાહેર ખરબ નોટીસથી કોઇપણ જાતનું વેચાણનું પ્રમાણ કે સોંપણીની જવાબદારી નો ખાતરી આપવામાં આવતી નથી. સુરક્ષિત લેણદાર બેંક અથવા અધિકૃત અધિકારીની કોઇપણ જાતનું વર્ડ પાર્ટી દાવો, સ્કક કે લેણાની જવાબદારી રહેશે નહીં. . જે વ્યક્તિ આ ઇ-દરરાજીમાં દાવેદાર સાબિત થાશે તેમણે વેચાણની કુલ કિંમત ૨૫% (ઇએમડી રક્કમ બાદ કરી) તરત જ જમા કરવાની રહેશે. વેચાણ નક્કી થાય એટલે બાકીની રક્કમ દેવામાં નિષ્ફળ જાય તો તેનો દાવો જતો કરવામાં આવશે. અને તેમણે જમી કરાવેતી ઇએમડી રક્કમ પણ પરત કરવામાં નિષ્ફળ જાય તો તેનો દાવો જતો કરવામાં આવશે. અને તેમણે જમી કરાવેતી ઇએમડી રક્કમ પણ પરત કરવામાં નિષ્ફ કરફાર કરવાની અબાધિત અધિકાર ધરાવે છે.
- . બેર્કે જ્ઞારા ઇન્ક્સરાજી મુતાવી રાખવું કે રહ કરવું તેમજ ઇન્ક્સર્જીઓ કોઇપણ શસ્ત્રીઓ ફેસ્ફાર કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. . વધુ વિગત માટે સંપર્ક શ્રી સચીન વર્મા, ચીફ મેનેજર સંપર્ક નં. 0281-2589790 મો. નં. 7043337028 Email cb488@corpbank.co.in. સંપૂર્ણ શાખાનું સરનામુ : કોર્પોરેશન બેંક, એસએમઇ શાખા, ૧૦૧, પ્રથમ માળ, ગાયત્રી કોમર્શિયલ સેન્ટર, પરિમલ સ્કૂલ સામે, કાલાવક રોક, રાજકોટ-૩૧૦૦૦૫ અથવા ઇ-હરરારજી મે. ઇ-પ્રોક્ચોરમેન્ટ ટેકનોલોજીસ લી. (ઓક્શન ટાઇગર), અમદાવાદ. શ્રી જીનેશ જરાવાલા મો.9537046315 gujarat@auctiontiger.net, શ્રી રીકીન બ્રહ્મક્ષત્રિય મો.9978591888 rikin@auctiontiger.net સંપર્ક નં. 079-40230802/821/813/814/815/816/817/818/822. ટેકનિકલ ઇમેલ આઇડી :
- support@auctiontiger.net. આ જાહેર ખબર નોટીસ દ્વારા બાકી દેણદારો/ગેરેન્ટરો/મોર્ટગેજરોને ૧૫ દિવસની બાકી દેણા જમા કરાવવાની નિયમ ૮ અને ૯ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ નિયમ

૧૦. મિલ્કતોનું વેચાણ એએ નં. ૮૯/૨૦૧૭ જે ડીઆરટી-ાા, અમદાવાદ ઓફિસને આધિન છે.

સ્થળ : રાજકોટ તારીખ ઃ ૦૯/૦૩/૨૦૧૮ અધિકૃત અધિકારી કોર્પોરેશન બેંક